

સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરતું શ્રીસ્વા-મંદિર-સરદારનું મુખપત્ર

# સ્વામિનારાયણ ચિંતન

એપ્રિલ - ૨૦૧૫

બે વર્ષ લવાજમ રૂ. ૧૬૦/-

ગઢપુરપતિ શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજના

દિવ્ય સાન્નિધ્યમાં અમદાવાદ શ્રી નરનારાયણ દેવ

ગાદી પીઠાધિપતિ પ.પૂ. ૫.૫. ૧૦૦૮

શ્રી આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના

પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું

દિવ્ય મિલન





ડોંબીવલીને આંગણે પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ તેમજ મહિલા મંદિરની પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત યોજાયેલ 'શ્રી સ્વામિનારાયણ સત્સંગ ઉત્કર્ષ મહોત્સવ' તથા પ.પૂ. લાલજી મહારાજશ્રીનો '૪૧મો જન્મોત્સવ' તથા પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના વક્તાપદે 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ' (તા. ૧૪ થી ૨૦-૩-૨૦૧૫)

૧-૨-૩. પ.પૂ. લાલજી મહારાજશ્રીના ૪૧મા જન્મોત્સવની ઉજવણીમાં પૂ. સ્વામી, પૂ. ભંડારી શ્રી બ્રહ્મસ્વરૂપ સ્વામી, શ્રી માયાભાઈ આહિર તથા યજમાન ભક્તો. ૪. સુકામેવાના ૪૧ ફૂટ હારથી પ.પૂ. લાલજી મહારાજશ્રીનું પૂજન કરતા કૂર્લા સત્સંગ સમાજ. ૫. ગુલાબ-પુષ્પના ૪૧ ફૂટ હારથી પ.પૂ. લાલજી મહારાજશ્રીનું પૂજન કરતા ડોંબીવલી સત્સંગ સમાજ. ૬. ગુલાબ-પુષ્પના ૪૧ ફૂટ હારથી પ.પૂ. લાલજી મહારાજશ્રીનું પૂજન કરતા શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ-ભૂલેશ્વર. ૭. જુદા-જુદા પુષ્પોથી બનાવેલ ૪૧ ફૂટ હારથી પ.પૂ. લાલજી મહારાજશ્રીનું પૂજન કરતા થાણા સત્સંગ સમાજ. ૮. કથાના વક્તાશ્રીનું પૂજન કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૯. ટિપ્પ પ્રાગટ્ય કરતા પૂ. લાલજી મહારાજશ્રી તથા સંતો-ભક્તો. ૧૦. મહોત્સવનો લાભ લેતા ડોંબીવલી તથા મુંબઈ પરાવિસ્તારના હજારો ભક્તજનો.

સ્વામિનારાયણ ચિંતન, એપ્રિલ - ૨૦૧૫ (૨)





ડોંબીવલીને આંગણે પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ તેમજ મહિલા મંદિરની પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત યોજાયેલ 'શ્રી સ્વામિનારાયણ સત્સંગ ઉત્કર્ષ મહોત્સવ' તથા પ.પૂ. લાલજી મહારાજશ્રીનો 'જયમો જન્મોત્સવ' તથા પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના વક્તાપદે 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ' (તા. ૧૪ થી ૨૦-૩-૨૦૧૫)

૧. મહિલા મંદિરમાં ભગવાન શ્રીહરિના અર્ચાસ્વરૂપની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૨-૩. મુખ્ય મંદિરમાં બિરાજમાન સંકલ્પસિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજનું પોડુપોપચાર પૂજન-અર્ચન કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૪. શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ ધરાવેલ છપ્પનભોગ અન્નકૂટની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૫. પુનઃ પ્રતિષ્ઠા પ્રસંગે યોજાયે શ્રીહરિ યાગમાં બીડું હોમતા પ.પૂ. લાલજી મહારાજશ્રી સાથે પૂ. સંતો તથા યજમાનો. ૬. કથા અંતર્ગત જેતપુર ગાદિ-પટ્ટાભિષેક પ્રસંગે ઠાકોરજીનો પંચામૃત જળથી અભિષેક કરતા પૂ. સંતો તથા યજમાનો. ૭. મહોત્સવ અંતર્ગત યોજાયેલ શ્રી માયાભાઈ આહિરનો લોકગાયરો. ૮. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી આશિષભાઈ રમેશભાઈ માનસેતા પરિવારને સ્મૃતિચિહ્ન અર્પણ કરતા પૂ. સ્વામી. ૯. કથાના મુખ્ય યજમાન શ્રી દેવાંગભાઈ તથા ઉમંગભાઈ મોહનભાઈ ચંદન પરિવારને સ્મૃતિચિહ્ન અર્પણ કરતા પૂ. સ્વામી. ૧૦. સમગ્ર મહોત્સવના સહ યજમાન શ્રી સિદ્ધાર્થ અમિતભાઈ લાખાણી પરિવારને સ્મૃતિચિહ્ન અર્પણ કરતા પૂ. સ્વામી. ૧૧. કથા સહયજમાન શ્રી હંમત તથા સચીનભાઈ મૂલચંદભાઈ પટેલ પરિવારને સ્મૃતિચિહ્ન અર્પણ કરતા પૂ. સ્વામી. ૧૨. પૂ. સ્વામી સાથે ડોંબીવલી મંદિરના ટ્રસ્ટીશ્રીઓ.



શ્રીમદ્ ભાગવત કથા  
મહોત્સવ - સરઘાર



સરઘારધામને આંગણે પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી તથા પ.પૂ. લાલજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સમસ્ત ગામ સમાજ  
દ્વારા પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના વક્તાપદે યોજાયેલ 'શ્રીમદ્ ભાગવત કથા પારાયણ' (તા. ૨૧ થી ૨૭-૩-૨૦૧૫)

સ્વામિનારાયણ ચિંતન, એપ્રિલ - ૨૦૧૫ (૪)





॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરતું શ્રી સ્વામિનારાયણ મંદિર - સરદારનું  
રજિસ્ટર્ડ મુખપત્ર ઈ.સ. ૨૦૦૫ના જૂન માસથી પ્રારંભાયેલું, દર માસની ૨૦ તારીખે  
પ્રકાશિત થતું, આપના સમગ્ર કુટુંબ-પરિવારમાં આનંદ અને સંસ્કારની સૌરભ  
પ્રસારાવે અને જીવનનું અનેરું ઘડતર કરતું સામયિક.

# સ્વામિનારાયણ ચિંતન

વર્ષ : ૩, અંક : ૩, તા. ૨૦-૦૪-૧૫

પ્રયોજક :- પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

:: પ્રસિદ્ધ કર્તા ::

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય શ્રી લક્ષ્મીનારાયણ દેવ  
પીઠસ્થાન સંસ્થાન -વડતાલ વતી

**શ્રી સ્વામિનારાયણ મંદિર - સરદાર**  
તા.જી. રાજકોટ - ૩૬૦૦૨૫.

**પ્રકાશક/માલિક/તંત્રી :-** સાધુ પતિતપાવનદાસજી  
**સંપાદક :-** સ્વામી આનંદસ્વરૂપદાસજી (વેદાંતાચાર્ય)

સંકલન : સાધુ અમૃતસ્વરૂપદાસજી  
ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

લવાજમ દર અંગે ગ્રાહક પત્ર વ્યવહાર :-

**ચિંતન કાર્યાલય**

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરદાર,  
તા.જી. રાજકોટ - ૩૬૦૦૨૫. ફો.નં. ૦૨૮૧ - ૨૭૮૧૨૧૧  
[www.sardhardham.com](http://www.sardhardham.com), [www.svg.org](http://www.svg.org)  
Email : [srdharmandir@gmail.com](mailto:srdharmandir@gmail.com)

**અમૃતવાણી**

‘નિન્દન્તુ નીતિનિપુણા યદિ વા સ્તુવન્તુ ।  
લક્ષ્મીઃ સમાવિશન્તુ ગચ્છન્તુ વા યથૈષ્ટમ્ ॥  
અદ્યૈવ વા મરણસ્તુ યુગાન્તરે વા ।  
ન્યાય્યાત્ પથઃ પ્રવિચલન્તિ પદં ન ધીરા ॥’  
નીતિના નિષ્ણાતો નિંદા કરે કે સ્તુતિ, લક્ષ્મી ફાવે તેમ  
આવે ને જાય, આજે જ મરણ થાય કે યુગ વીત્યા પછી  
થાય, પણ ધીર-વીર પુરુષો ન્યાયના માર્ગમાંથી ડગલું  
પણ હઠતા નથી.

**અનુક્રમણિકા**

- |  |    |
|--|----|
| ૧. પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની<br>દિવ્ય અમૃતવાણી                 | ૦૬ |
| ૨. પૂ. સદ્ગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના શ્રીમુખે ગવાયેલ<br>શ્રીમદ્ સત્સંગિજીવન કથા અમૃતકણિકા | ૧૧ |
| ૫. સત્સંગ સમાચાર પત્રિકા   | ૨૧ |

**લવાજમ દર :-**

બે વર્ષ : રૂ. ૧૬૦/-, પંચવાર્ષિક : રૂ. ૩૫૦/-, પચ્ચીસ વર્ષ : રૂ. ૭૫૦/-  
પરદેશમાં લવાજમ : \$ 200 U.S.A. £ 125 U.K.



Online : [www.lakshyatv.com](http://www.lakshyatv.com)

પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય  
શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની  
**દિવ્ય અમૃતવાણી**

સમય : દરરોજ

પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના  
સત્સંગ શ્રીમુખે  
**કથા પારાયણ**

સમય : દરરોજ રાત્રે ૮.૦૦ થી ૧૧.૦૦

પૂ. સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજીના શ્રીમુખે  
**સત્સંગ કથામૃત**

સમય : દરરોજ સવારે ૫.૩૦ થી ૭.૩૦

છબીકલા : શિવલાલ સુદાણ - બારમણ, મો. ૯૮૭૯૮૬૮૫૪૦ શ્રીહરિકૃષ્ણ વિડિયો વિઝન - સુરત, મો. ૯૪૨૮૬૮૫૫૧૩. શ્રીહરિ ડીઝીટલ સ્ટુડીયો - સુરત, મો. ૯૮૨૫૦૩૦૨૫૦ ૫



પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય  
શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની

# દિવ્ય અમૃતવાણી



ભવસંભવભીતિભેદનં સુખસંપત્કરુણાનિકેતનં ।  
વ્રતદાનતપઃક્રિયાફલં સહજાનંદ ગુરું ભજે સદા ॥  
તં સુકાયભૂતં કાન્તં સર્વતોગતમ્ ।  
તં ગતોદ્દેગદેવં તં તં વન્દે ભક્તિકાસુતમ્ ॥

સર્વાવતારી, સર્વકારણ કારણ, આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં સમગ્ર સુરત શહેર પર જેમની કૃપાદષ્ટિ હંમેશા રહેલી છે એવા સુરત મંદિરમાં બિરાજમાન શ્રી નારાયણમુનિ દેવના દિવ્ય સાન્નિધ્યમાં યજમાન પરિવારના સંકલ્પથી આયોજીત 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ'ના શુભ પ્રસંગે તેમજ આજે વિશેષ કરીને કથા અંતર્ગત બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યોત્સવના મંગળ અવસરે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત અમારા બાલા સર્વ સંતો તથા શ્રીજીના લાડીલા બાલા સર્વ હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો અને મોક્ષભાગી જીવાત્માઓ.

સર્વ સંતો-હરિભક્તોને અમારા હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.

સૌપ્રથમ તો બે યોગવટ કરી દઈ. પછી પ્રસંગોપાત વાત આગળ વધારીએ. અત્યારે જે પૂર્વવક્તાઓએ પોતાની જે ભાવના, જે એમની વ્યક્તિગત લાગણીઓ રજૂ કરી છે, તેમાં અમારું એવું માનવું છે કે પોતાની જે સંપ્રદાયમાં કોઈ અજ્ઞાની વ્યક્તિ હોય અને એનાથી નુકસાન થતું હોય તો કદાચ સમજી શકાય પણ જેને આપણે સારા ગણીએ છીએ ને એના દ્વારા સંપ્રદાયના સિદ્ધાંતો તૂટી રહ્યા છે, એના દ્વારા સંપ્રદાયનું ખંડન થઈ રહ્યું છે એનાથી હૃદય ઉકળી રહ્યું છે અને એ ઉકળાટ, એની અભિવ્યક્તિ એમણે કરી છે એટલે કોઈ શબ્દોને ન પકડશો. અને ક્યારેય પણ હિંસાત્મક કે કાયદો હાથમાં લઈને કોઈપણ કાર્ય ના કરશો. કાયદાની મર્યાદામાં રહીને આપણી ધર્મ અને ધર્મ સિદ્ધાંતની લડત છે, એ લડતને આપણે સૈદ્ધાંતિક રીતે, ભગવાન શ્રીહરિની આજ્ઞામાં, મર્યાદામાં રહીને આપણે કાર્યસિદ્ધિ સુધી પહોંચાડશું અને ભગવાન શ્રીહરિ પણ એમાં આપણને

સફળતા આપશે એમાં કોઈ સંશય રાખશો નહિ.

દરેક કાર્યની પાછળ



એનો એક હેતુ રહેલો હોય છે. હેતુને જો કાર્યથી છૂટું પાડી દેવામાં આવે, અલગ કરી દેવામાં, હેતુ કાઢી નાખીએ તો એની કોઈ કિંમત રહેતી નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણનું પણ આ ધરા ઉપર જે પ્રગટ થવું તેમાં પણ ઉદ્દેશ રહેલો છે, હેતુ રહેલો છે. શ્રીમદ્ ભગવત્ ગીતાના શબ્દોમાં કહીએ તો ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત !’ જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનો વ્યાપ વધે છે ત્યારે ભગવાને બે ઉદ્દેશ બતાવ્યા છે. ‘પરિત્રાણાય સાધુનાં’ ભગવાનના જે એકાંતિક ભક્તો છે, મુક્તો છે, સાધુપુરુષો - સજ્જન પુરુષો છે એના રક્ષણને માટે ‘વિનાશાય ચ દુષ્કૃતામ્’ અને આસુરી બુદ્ધિથી, વૃત્તિથી, કર્મથી ધર્મને હાનિ પહોંચાડનારા વ્યક્તિઓ છે એનો વિનાશ થાય, એનું મૂળ ઉખાડવાને માટે ‘ધર્મ સંસ્થાપનાર્થાય’ ધર્મનું સ્થાપન કરવાને માટે ‘સંભ્રામિ યુગે યુગે’ દર યુગમાં અમે પ્રગટ થઈએ છીએ. વચનામૃતમાં શ્રીજીમહારાજ આ વાતને થોડા વિસ્તારથી સમજાવે છે કે,

ધર્મનું સ્થાપન તો અમારો ઉદ્દેશ હોઈ શકે, પણ જો કેવળ ધર્મ સ્થાપન અમારો ઉદ્દેશ હોય તો અમારી એવી સામર્થી છે કે અમારે એના માટે આ ધરા પર મનુષ્ય આદિ તનુ ધારણ કરવા ન પડે, અવતારો ધારણ ન કરવા પડે. એ તો અમે અમારા આચાર્યો દ્વારા, ઋષિમુનિઓ દ્વારા પણ કરાવી શકીએ. પરંતુ કેવળ એ અમારો ઉદ્દેશ નથી. ધર્મ સ્થાપનની સાથે-સાથે ભક્તોના ભાવ અને ભક્તોના જે મનોરથ છે એને પૂરા કરવા, ભક્તોને આનંદ આપવા માટે, ભક્તોને સંતોષ અને સુખની પ્રાપ્તિ કરાવવાને માટે અમે આ લોકમાં પ્રગટ થઈએ છીએ.

પરમાત્માનું મૂળ જે સ્વરૂપ છે, જેમાં જેને શાસ્ત્રોએ સત્, ચિત્ અને આનંદનું સ્વરૂપ સમજાવ્યું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ બતાવ્યું છે એવું જે સત્ય છે, સદાકાર છે, નિરંતર આનંદ આપનારું જે ભગવાનનું સ્વરૂપ છે એના જીવાત્માને દર્શન થાય, એમાંથી મધુર એવી જે



સત્તા અને સ્થાન એ આપણો ઉદ્દેશ હતો નહિ, છે નહિ અને થવાનો પણ નથી. એ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના બોળે જન્મ્યો છું, એના કુળમાં જન્મ્યો છું આનાથી વિશેષ પારિતોષિક અમોને આ જગતમાં કંઈ કોઈ આપી શકે એમ નથી.

નીકળતી કાંતિ, એમાંથી નીકળતું તેજ, આપણે નિત્ય ઓરડાના પદોમાં પણ ગાઈએ છીએ ‘શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય...’ જેના આવરણમાં આવવાથી આપણા મનમાં ગમે તેટલી ઉગ્રતા હોય, ગમે તેટલો તાપ આપણને બાળતો હોય પણ પરમાત્માના સાશ્વિયમાં, પરમાત્માના એ વર્તુળમાં જ્યારે એ જીવાત્મા આવે તો એ પરમાત્માના પ્રભાવે કરીને એના હૃદયમાં શીતળતાની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય, પરમસુખની અનુભૂતિ થાય. એ સુખ આપણને આપવાને માટે આ ધરતી પર પૂર્ણ પુરુષોત્તમનારાયણ અને તેના અવતારોનું પ્રાગટ્ય થાય છે એ એનો મૂળ હેતુ છે. આ પરંપરા યુગોથી ચાલી આવે છે પણ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે વિશેષ કરીને આ સંપ્રદાયમાં ઉપાસના-ભક્તિને પ્રાધાન્ય આપી મુમુક્ષુઓના જીવનમાં આચાર અને વિચાર બંનેની શુદ્ધિને સમજાવી છે.

ભક્તિનો મહિમા, ધર્મનો મહિમા, જ્ઞાનનો મહિમા અને વૈરાગ્યનો મહિમા તો યુગોથી ગવાતો હતો, પરંતુ બધાનું સમન્વય કરીને ભગવાનની પ્રસન્નતાઈ કરવો જોઈએ આવો જો ઉપદેશ જો સ્પષ્ટ કરીને સમજાવ્યો હોય તો વચનામૃતમાં શ્રીજીમહારાજે સમજાવ્યો છે. ભગવાનને રાજી કરવાના સાધનો તો સત્શાસ્ત્રોએ યુગોથી આપેલા છે પણ એ સાધનો કેવી રીતે સાર્થક થાય એનો માર્ગ આપણને આપ્યો હોય તો આ ષડ્ઝંગી (દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત, હરિભક્ત) સંપ્રદાયનું માળખું બનાવીને ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને બતાવ્યો છે. ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં સ્પષ્ટપણે લખ્યું છે : “આ શિક્ષાપત્રીને જે અનુસરશે તે આ લોક અને પરલોકમાં મહાસુખિયો થશે, અમારી બાંધેલી મર્યાદામાં ને આજ્ઞામાં જે રહેશે એનું પરમ શ્રેય થશે.” જેમ મનુષ્યજીવનનો એક જન્મનો હેતુ છે, શાસ્ત્રોની દૃષ્ટિએ જો





એનું મૂલ્યાંકન કરવા જઈએ તો જીવનમાં આપણે બે કાર્ય કરવા આ લોકમાં આવીએ છીએ. ૧. પૂર્વે કરેલા કર્મનું ફળ ભોગવવા અને ૨. ભવિષ્ય માટે, ફરી બંધન ન થાય, ફરી જન્મ-મરણના ચક્રમાં ન આવવું પડે એના માટે પોતાના કર્મને સુધારવા. આ બંને ઉદ્દેશને સમન્વય કરી સત્સંગમાં જો જીવન જીવીએ તો શાસ્ત્રો એમ કહે છે કે, એવા જીવાત્માઓ ભવબંધનમાં મુક્ત થઈ શકે છે. અને આવી સમજણ આપણને સત્શાસ્ત્રો દ્વારા મળે છે.

આજે એટલા માટે જ આપણા સૌના જીવનમાં જે આનંદનો અહેસાસ જે અનુભૂતિ જીવંત છે એનું કારણ એ જ છે કે, આપણે ભગવાનને યથાર્થપણે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. ભગવાનની પ્રાપ્તિ માટે આપણે રાત-દિવસ મહેનત પણ કરીએ છીએ અને એ લક્ષ્યને આપણે સ્પષ્ટ કરીને રાખ્યું છે. આપણો ધ્યેય, આપણો ઉદ્દેશ ક્યારેય ભટકવા દીધો નથી. માટે આપણને ક્યારેય એનાથી શોક કે ગ્લાનિ થવા સંભવ નથી. અમોને એક બહુ સુંદર વાત આ બધા હમણા વાતાવરણની જે વાત કરી એ વાતાવરણમાં કોઈવખત મનુષ્ય સ્વભાવે કરીને અમે પણ જ્યારે પરિણામો જાણ્યા ત્યારે મનમાં એક સંકલ્પ થયો કે, સંતો-ભક્તોએ કેટલી મહેનત કરી. પરંતુ જો કે અમોને એક વાતનો આનંદ છે, ગૌરવ છે કે આ સત્સંગ સમાજ પર, અમોને ગૌરવ છે એ કેવળ એટલા માટે નહિ કે સત્સંગ સમાજ ધર્મના પક્ષે, સિદ્ધાંતના પક્ષે કે અમારા પક્ષે મહેનત કરી છે અને કરે છે. પરંતુ કેવળ પાંચ દિવસના ટૂંકા સમયમાં જે બિનસત્સંગીઓ હતા, જેમના નામ આપણી (મતદાર) યાદીમાં હતા, જેને સ્વામિનારાયણ પણ બોલતા નહોતું આવડતું એવાના ઘરે જઈને એવા વ્યક્તિઓને ગોતી-ગોતીને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેઓના ઉદ્દેશ, મહિમા, સંપ્રદાયની ગરિમા, મૂળ પરંપરા વગેરે મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા. અને એનું પરિણામ એવું આવ્યું કે, એ હરિભક્તોએ ગામડે-ગામડે, ઘરે-ઘરે જઈને જે બિનસત્સંગીઓ હતા એમને આ પરિસ્થિતિ સમજાવી. અમોને આનંદ એ વાતનો છે અને આશ્ચર્ય પણ એ વાતનું છે કે પેલા જે બિનસત્સંગી હતા એને સંપ્રદાયની પરંપરા અને મહિમા સમજાણો, પણ જે નખશિખ જાણે છે તેને નથી સમજાતો તેનું આશ્ચર્ય છે....!! અમારા યુવાનો-હરિભક્તો એ સમજાવવા મહેનત કરી, પાંચ દિવસમાં જે બિનસત્સંગીઓ હતા એને પણ સત્સંગનો મહિમા

સમજાવીને ધર્મ અને સિદ્ધાંતના માર્ગે લાવી શક્યા એનું અમને ગૌરવ છે. બહાલા ભક્તજનો ! પ.પૂ. આચાર્ય મહારાજશ્રી કાયમ કહે છે કે આપણો ઉદ્દેશ સત્તા ક્યારેય નથી. સત્તા અને સ્થાન એ આપણો ઉદ્દેશ હતો નહિ, છે નહિ અને થવાનો પણ નથી. એ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના બોળે જન્મ્યો છું, એના કુળમાં જન્મ્યો છું આનાથી વિશેષ પારિતોષિક અમોને આ જગતમાં કંઈ કોઈ આપી શકે એમ નથી. ભગવાનના દીકરા થવાની જે ઉપાધિ અમોને પ્રાપ્ત થઈ છે એનાથી વિશેષ કોઈ પારિતોષિક, કે કોઈ સ્થાનની એમાં આવશ્યકતા નથી. અને જે સેવા એ આમ રહીને કરાય કે આમ રહીને કરાય કે પછી આમાં રહીને કરાય; સેવા ભગવાન શ્રીહરિની પ્રસન્નતાને અર્થે કરવાની છે એટલે એમાં કોઈ ફેર પડતો નથી. પ્રશ્ન એ છે કે, જ્યારે આ બધા પ્રશ્નો સાંભળ્યા ત્યારે અમો ભગવદ્ ગીતાજીનો પાઠ કરતા હતા. મન જ્યારે મૂંઝાય ત્યારે શાસ્ત્રનો આપણા આચાર્યઓએ-ઋષિમુનિઓએ-સંતોએ માર્ગ આપણને બતાવ્યો છે, સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ બતાવ્યો છે. જ્યારે ઉદ્વેગ થાય, મનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે શાસ્ત્રોનો આશ્રય લેવો જોઈએ. એટલે હું ગીતાજી વાંચતો હતો.

શ્રી ભગવદ્ ગીતામાં એક બહુ સુંદર ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણચંદ્રજીએ અર્જુનજીને આપ્યો છે. મહાભારતની કથામાં આ પ્રસંગ બહુ વિસ્તારથી લખ્યો છે. એટલું એનું અનુસંધાન જોઈએ તો પ્રસંગનો ઉપદેશ તુર્ત સમજાશે. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ એક શૂરવીર યોદ્ધા હતો. ઉંમર નાની, અર્જુનજીના પુત્ર અને ભગવાન શ્રીકૃષ્ણના એ શિષ્ય. એમના પરાક્રમથી સમગ્ર કૌરવસેના હચમચી ગઈ હતી. અને એટલે ચક્રવ્યૂહની રચના કરીને અભિમન્યુને કપટથી મારવામાં આવ્યો છે એવો મહાભારતમાં પ્રસંગ આવે છે. એક અભિમન્યુને પરાસ્ત કરવા માટે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ જેવા મહારથીઓ બધાય ભેગા થઈને - એક થઈને એક યોદ્ધા પર તૂટી પડ્યા છે. આ બધું સરખાવીએ ને તો સંપ્રદાયમાં આવું જ આપણને દેખાય આવે છે. છેવટે કપટથી અભિમન્યુનો વધ થયો છે.

અભિમન્યુના મૃત્યુનું કારણ શું? દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરી. ચક્રવ્યૂહના દ્વાર તોડવાના હતા, ભેદવાના હતા. અભિમન્યુએ છ કોઠા તોડી શક્યો. છ કોઠા ભેદીને અભિમન્યુ સાતમા કોઠામાં પ્રવેશી ગયો પણ ભીમ



આદિ જે એમના રક્ષણમાં હતા એ પાર ન કરી શક્યા ને અંતે અભિમન્યુ ત્યાં એકલો પડ્યો અને એનું મૃત્યુ થયું. ત્યારે અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી છે કે, કાલ સૂર્યાસ્ત સુધીમાં અભિમન્યુનો વધ કરનારનો વધ કરું યા તો હું અગ્નિપ્રવેશ કરું. બીજે દિવસે બધા ગભરાયા. જયદ્રથનો વધ થાય તો આપણું નાક જાય એટલે દ્રોણાચાર્યની પાસે રાત્રે મંત્રણા કરી છે અને દ્રોણાચાર્યે ત્રણ વ્યૂહ : ૧. શકઠ વ્યૂહ ૨. ચક્રવ્યૂહ અને ૩. શૂજિપાય વ્યૂહ - એમ ત્રણ વ્યૂહની સંયુક્તની રચના કરીને જયદ્રથને રક્ષણ આપ્યું છે.

અર્જુનજી પણ મૂંઝાણા. એકાદ વ્યૂહને તોડવો-ભેદવો હોય ને એક ચક્રવ્યૂહને ભેદવું હોય ને તો ઘણી મુશ્કેલી, એક શકઠ વ્યૂહને ભેદવું હોય તોય ઘણું કઠણ પડે. આ તો ત્રણેય વ્યૂહનું મિશ્રણ કર્યું. દ્રોણાચાર્ય ગુરુ હતા. સ્વાભાવિક રીતે ગુરુનું જ્ઞાન શિષ્ય કરતા એક વેંત વધારે હોય. પરંતુ દ્રોણાચાર્યના એ વ્યૂહને તોડવા માટે અર્જુનજીએ ખૂબ મહેનત કરી છે. એકબાજુ એમની દૈષ્ટિ સૂર્ય ઉપર છે. કારણ કે, સૂર્યાસ્ત પહેલા વધ કરવાનો છે ને જો વધ ન કરે તો પોતે અગ્નિસમાધિ લેવાની પ્રતિજ્ઞા કરેલી છે. જેમ જેમ સાંજ ઢળવા લાગી તેમ-તેમ અર્જુનજી વધારે મૂંઝાણા છે. થોડી થોડી વારે સૂર્ય ઉપર દૈષ્ટિ નાખે છે. પછી જ્યારે અસ્તાચળ તરફ સૂર્યે વધારે ગતિ કરી ત્યારે અર્જુનજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું : “હે કેશવ ! જો જયદ્રથને આજે સાંજ સુધી નહિ મરાય તો શું થશે ? જો તેનો વધ કરવામાં નહિ આવે તો મારે અગ્નિસમાધિ લેવી પડશે અને હું ક્ષત્રિય છું ને મેં પ્રતિજ્ઞા કરી છે તો મારે અગ્નિસમાધિ લેવી જ પડશે. તો કેમ થશે ?” ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને બહુ સુંદર અર્જુનજીને ઉત્તર કર્યો : “હે અર્જુન ! હે પાર્થ ! બે વસ્તુનો ખાસ જીવનમાં અનુસંધાન રાખજો. ધર્મ અને ન્યાય-સિદ્ધાંતની ક્યારેય પીછેહઠ નથી હોતી. તેનો ક્યારેય પરાજય નથી હોતો. દ્રોણાચાર્ય ભલે તમારા ગુરુ છે, તમારાથી વધારે જ્ઞાની છે, વધારે હોશિયાર-બુદ્ધિશાળી છે અને તમને પરાસ્ત કરવા માટે એમણે કદાચ આ વ્યૂહની રચના કરી, તમને પરાસ્ત કરવા માટે ભલે ગમે તેટલી વ્યૂહરચના કરી હોય પણ એ ભૂલી ગયા છે કે એના પણ ઘણી તરીકે હું બેઠો છું. અને મારી જ્યારે વ્યૂહરચના કામ કરશે ત્યારે એ કોઈની વ્યૂહરચના ત્યાં નહિ ચાલે. ભલે થોડી મહેનત કરે, એને કરવા દો. પણ ધર્મનો, સિદ્ધાંતનો, ન્યાયનો પરાજય શક્ય નથી અને થવો પણ ન

જોઈએ.” બહાલા ભક્તો ! જે દિવસે ધર્મનો પરાજય થશે તે દિવસે આ ધરતી રસાતળ થઈ જશે. સંપ્રદાયમાં એવા જે બુદ્ધિજીવીઓ છે તેને આ વિચારવાની જરૂર છે. ‘શોકચની દાઝે ઘણીનો ખાટલો ન બળાય...’ આવી આપણી ગુજરાતીની જાડી ભાષાની કહેવત છે. આ વાતને સમજવાની - પચાવવાની જરૂર છે. માત્ર એક અહંકાર, પોતાના સ્વાર્થને પોષવા માટે અમો બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઘોર ન ખોદશો. આમાં કોઈનું હિત નથી. જે સિદ્ધાંતને તોડીને, જે પરંપરાને તોડીને, ભગવાન શ્રી સ્વામિનારાયણે બાંધેલી જે મર્યાદા તેનો ભંગ કરીને તમે તમારા અહંને પોષવા માંગો છો, તમારા સ્વાર્થને પોષવા માંગો છો એનાથી તમારું પણ કલ્યાણ થવાનું નથી અને હજારો જીવાત્માનું કલ્યાણ બગડશે એનું પાપ તમને પણ લાગશે. માટે ફરી કહું છું કે પાછા વળી જજો.

ભગવાન શ્રીકૃષ્ણચંદ્રજીએ અર્જુનજીને બહુ સુંદર વાત કરી કે, કૌરવોની વ્યૂહરચના છે તે એકબાજુ રહેશે. ધર્મને જ્યારે રક્ષા કરવાની વાત - આવા પ્રસંગ મહાભારતમાં બે વખત આવે છે. એક જ્યારે ભીષ્મપિતામહે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને જ્યારે પાંડવો ઉપર હાવી થઈ ગયા છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણજીને અર્જુનજીએ કહ્યું કે હવે મારા કહ્યામાંથી, મારા એકથી ભીષ્મ પિતામહ રોકાશે નહિ. ત્યારે ભગવાને પોતે હાથમાં શસ્ત્ર ન લેવાની પ્રતિજ્ઞા હોવા છતાં પોતે રણભૂમિમાં હાથમાં એક રથના પૈડાંને પોતે સુદર્શનચક્ર બનાવી ભીષ્મપિતાને મારવા દોડ્યા છે. અને બીજો પ્રસંગ જયદ્રથના વધ વખતે પણ ભગવાન શ્રીકૃષ્ણે માયાનું સર્જન કર્યું. સૂર્ય અસ્ત થઈ ગયો હોય એવી આભા ઊભી કરી અને જ્યારે જયદ્રથને છૂપા સ્થાનેથી બહાર કાઢ્યો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માયા સંકેલી લીધી અને અર્જુનને કહ્યું : “જો અર્જુન ! હજુ સૂર્યાસ્ત નથી થયો. તારા હાથમાં ગાંડીવ ઉઠાવ અને જયદ્રથનો વધ કર.” પ્રભુના કહેવાથી અર્જુને શક્તિશાળી તીરથી જયદ્રથને વીંધી નાખ્યો.

જયદ્રથના દુષ્ટ પાપાચારી પિતાએ તેને વરદાન આપ્યું હતું કે જે વ્યક્તિ થકી તેનું માથું ધરા પર પડશે તેનું માથું ફાટી તત્કાલ મૃત્યુ થશે. જ્યારે અર્જુને જયદ્રથનું માથું ઘડથી જુદું કર્યું ત્યારે આ વરદાન દ્વારા તેનું મૃત્યુ પણ નક્કી હતું પણ ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે પડ્યાં અને તરત જ અર્જુનને





અન્ય તીર ચલાવવા કહ્યું. જેથી તેનું કપાયેલ માથું આશ્રમમાં ધ્યાનસ્થ તેના પિતાના જ ખોળામાં પડે. અર્જુને એક સાથે ત્રણ તીર ચલાવ્યા જે જયદ્રથના કપાયેલા માથાને તેના પિતાના ખોળા સુધી લઈ ગયા. જ્યારે તેમનું ધ્યાન પુરું થયું અને તે ઊભા થયાં ત્યારે તેમણે તે માથું ન જોયું અને તે ધરા પર પડી ગયું. આથી તેમનું જ માથું કાઢી ગયું.

જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને તેને જીવતો પકડી પાડે છે. યુધિષ્ઠર તેની હત્યા થતી રોકે છે પણ તેને બંદી બનાવી લે છે અને ભીમ તેનું મુંડન કરી દે છે. પોતાના આવા અપમાનનો બદલો લેવા જયદ્રથ શિવજીની તપસ્યા કરે છે તેમને પ્રસન્ન કરે છે અને પાંડવોને હરાવવાનું વરદાન માંગે છે. ત્યારે શિવજી કહે છે કે, તે અશક્ય છે. પણ તેને એવું વરદાન આપે છે જે થકી તે અર્જુન સિવાયના અન્ય પાંડવોને એક દિવસ સુધી રોકી શકે. ભલે શિવજી તેમના ભક્તોને, રાક્ષસ-અસુર કે અન્ય કોઈ દુષ્ટ ઉદ્દેશવાળા (જેમ કે જયદ્રથ)ની પણ તપસ્યાને વ્યર્થ નથી જવા દેતા અને વરદાન આપે છે, પણ તે સાથે જ તેઓ ધર્મને ભચાવવાના રસ્તા પણ શોધી લે છે અને અસત્યને સત્ય પર વિજયી થવા નથી દેતા. છેવટે અર્જુન જયદ્રથની હત્યા કરે છે અને એ વાત સિદ્ધ થાય છે કે જેના પક્ષે ધર્મ છે તેની ભગવાન રક્ષા કરે છે.

મહાભારતના ભીષણ યુદ્ધમાં અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને સાથે રાખ્યા, તેમનો આશરો કર્યો, તો તેમની રક્ષા થઈ. મહાભારત કહે છે : 'વતો કૃષ્ણસ્તતો ધર્મઃ વતો ધર્મસ્તતો જયઃ ।' - જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ છે, ત્યાં ધર્મ છે અને જ્યાં ધર્મ છે, ત્યાં જય છે. (મહાભારત, ભીષ્મપર્વ: ૬૧/૩૦)

શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ કહે છે : 'યત્ર યોગેશ્વરઃ કૃષ્ણઃ યત્ર પાર્થ ધનુર્ધરઃ । તત્ર શ્રીવિજયો ભૂતિ ધ્રુવા નીર્તમિર્તમ્ ।।' જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિયગ્નનીતિ છે, એવો મારો મત છે. (શ્રી ભગવદ્ ગીતા: ૧૮/૭૮)

કહેવાનું તાત્પર્ય એ છે કે, પ્રસંગ અને પરિસ્થિતિ એના નિયંતા ભગવાન શ્રી સ્વામિનારાયણ છે, આપણા ઈષ્ટદેવ છે. અને એ પરમાત્મા જ્યારે જે કાંઈ પણ નિર્માણ કરતા હશે, આ સર્વની ઉપર એના નિયંતા ભગવાન શ્રીહરિ છે. ભલે જે પણ વ્યૂહ રચવી હોય એ રચી લે પણ અધર્મને

(તેનાથી) ધર્મ-સિદ્ધાંતને ક્યારેય ભેદ નથી થઈ શકવાનો આ વાત નિર્વિવાદ છે. એટલા માટે કોઈ હિંમત ન હારશો કે હતાશ થશો નહિ, નિરાશ થશો નહિ. ભગવાન શ્રી સ્વામિનારાયણમાં અતૂટ વિશ્વાસ રાખજો. હંમેશા ભગવાન સત્ય અને ધર્મના પક્ષે રહ્યા છે અને એ જ આપણને આ સંપ્રદાયમાં સુખ-શાંતિની અનુભૂતિ કરાવવાના જ છે.

આજે આપણા માટે ખૂબજ આનંદનો દિવસ છે. જે છપૈયામાં ઋષિમુનિઓના, ભક્તોના, મુક્તોના ભક્તિના ફળસ્વરૂપે, એમની યાચનાના ફળસ્વરૂપે, એમની પ્રાર્થનાના ફળસ્વરૂપે ભગવાને મનુષ્ય તનુ ધારણ કરીને જેમ માવતર બાળકને જોઈને રાજી થાય તેમ ભગવાનના બાળસ્વરૂપના દર્શન કરીને સમગ્ર સત્સંગ ખૂબ રાજી થયો છે. છપૈયાવાસી ભક્તોના જેવો જ આનંદ-ઉત્સવ આજે આપણને માણવા મળ્યો છે ત્યારે ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે, સત્સંગમાં કાયમ આનંદ વર્તતો રહે એવી અમારી ઉપર કૃપા કરો. કદાચ અધર્મના વાદળા ઘેરાણા છે એ વાદળો વહેલી તકે હટી જાય અને સંપ્રદાયમાં આપના પ્રતાપનો પ્રકાશ પથરાય એવી અમે આપના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. માર્ગ ભૂલેલાને સદ્માર્ગે લાવજો. જેને જેના વડવાઓએ સંપ્રદાય માટે ભોગ દીધા છે, જેણે પોતાના સમગ્ર તન-મન-ધનથી આ સંપ્રદાયની સેવા કરી છે ત્યારે એક વાતનું આશ્ચર્ય થાય અને દુઃખ પણ થાય કે એમના વારસ થઈને પણ અવળે માર્ગે - ખોટા માર્ગે જતા હોય ત્યારે એવા જે ભક્તો છે એમને પણ સદ્માર્ગે વાળવામાં ભગવાન શ્રીહરિ આપ આપની કૃપા ખૂબ વરસાવજો. આજે એ ભક્તો વતી હું પ્રાર્થના કરું છું કે, શ્રીજીમહારાજ એમને સદ્બુદ્ધિ આપજો કે, અસત્યમાં, અધર્મમાં પોતે ન રહે અને સદ્ધર્મ ને સત્સંગના સાચા વિકાસમાં એ રહે.


'યાવત્ ચંદ્ર દિવાકરૌ' - સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી સંપ્રદાયનો દિગંત સુધી પ્રકાશ ફેલાય એ જ આપણો ઉદ્દેશ છે. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણનું નામ દિગંત સુધી ગૂંજે, પાંદડે-પાંદડે સ્વામિનારાયણનું નામ લખાય, હજારો, લાખો ને કરોડો જીવાત્માઓ ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભજન કરી અક્ષરધામના અધિકારી બને એ જ આપણો ઉદ્દેશ છે ને એ જ આપણો દ્યેય છે. (શ્રીમદ્ સત્સંગિજીવન કથા મહોત્સવ-સુરત, ૨૦૧૫)





પૂ. સદ્ગુરુ સ્વામી શ્રી  
નિત્યસ્વરૂપદાસજીના શ્રીમુખે ગવાયેલ

# શ્રીમદ્ સત્સંગિજીવન કથા અમૃતકણિકા



ગતાંકથી આગળ...

તેમણે શ્રીજીમહારાજની અંતઃપ્રેરણાથી દેહ મૂકવાને આગલે દિવસે પોતાના દીકરી વગેરે સંબંધીને તેડાવીને કહ્યું કે, “કાલે મને આ કથા પુરી થાય એટલે ભગવાન તેડવા પધારશે.” આમ કહ્યું અને સવારે થોડો સૂર્યનો તડકો તથ્યો તે સમયે કથાની પૂર્ણાહુતિ થયા બાદ તે દાદા કહે : “મને બહાર ખાટલો નાખીને નવરાવો, તુલસી ક્યારે દીવો કરો અને ભગવાનની મૂર્તિ અહીં સામે પધરાવો.” એમ કહેવાથી સંબંધીઓએ તડકે બેસારી સ્નાન કરાવ્યું અને ભગવાન શ્રીહરિનું સ્મરણ કરતા કરતા આંખો મીંચાઈ ગઈ અને સૌને ‘જય સ્વામિનારાયણ’ કહીને બપોરે ભગવાન શ્રીહરિ સાથે ધામમાં સીધાવ્યા.

ભક્તજનો ! આ પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણને મળ્યા છે. આવી તો હજારો સત્યઘટનાઓ આજે પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બનતી રહે છે.

❖ લંડનમાં એક હરિભક્તના ઘેર પધરામણી કરવા માટે ગયા હતા. ત્યાં એક વૃદ્ધ બાપા ખડેપડે પલંગ પર બેઠા હતા. સંતોએ ઓરડાના પદ બોલ્યા સાથે દાદા પણ બોલ્યા. પછી તેઓ કહે : “સંતો ! ક્યાંથી આવ્યા ?” અમે કહ્યું : “સરધારથી આવીએ છીએ.” ઓરડાના પદ પૂરા કરીને ઠાકોરજીની આરતી કરીને સંતો પણ બેઠા. પછી દાદાએ પોતે છોકરા પાસેથી ૫૦૦ પાઉન્ડ લઈને ઠાકોરજી પાસે ભેટ મૂકી.

પછી અમોએ કહ્યું : “દાદા ! ભજન ખૂબ કરજો.” ત્યારે દાદા કહે : “સ્વામી ! ભજન સિવાય કશું કરતો નથી. અને બીજું ક્યાં જેવું શું છે ? ભજન જ કરું છું. અને ભજન કરવા માટે તો મહારાજે આ મનુષ્યદેહ આપ્યો છે.”

આવી રીતે અમે બધી વાતો કરીને ત્યાંથી પાછા મંદિરે આવ્યા. મંદિરે પહોંચતા ફોન આવ્યો કે, આપણે જ્યાં પધરામણી કરવા ગયા હતા તે દાદા ધામમાં ગયા.

ત્યારે અમે કહ્યું : “દાદા તો હજુ તો હરતા-ફરતા હતા. અમારી સાથે આરતી ઉતારી, ઓરડાના પદ બોલ્યા. ઠાકોરજીને ભેટ ધરી.” પછી સામે જવાબ મળ્યો : “દાદા તો બોલીને ગયા કે, શ્રીજીમહારાજ મુક્તોની સાથે વિમાન લઈને મને તેડવા પધાર્યા છે. હવે હું મહારાજની સાથે ધામમાં જાઉં છું. અને તમારે પણ ધામમાં જવું હોય તો ભગવાન શ્રીહરિનું ભજન કરજો અને જો ભજન કરશો તો આપણે અક્ષરધામમાં ભેળા થઈશું. નહિતર તમારે ને મારે કાંઈ લેવા દેવા નહિ.” આટલું કહીને દાદાએ આંખો મીંચી દીધી. માટે ભગવાન શ્રી હરિ કહે છે : ‘મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું...’

➡ સ.ગુ. શ્રી આધારાનંદ સ્વામીએ ‘શ્રીહરિચરિત્રામૃતસાગર’ ગ્રંથમાં શ્રીજીમહારાજના ત્રણ ગુણની નોંધ કરી છે. ૧. રસોઈ હોય ત્યારે સંતોની પંક્તિમાં પીરસવા પધારતા. ૨. સંતો ગામડે સત્સંગ વિચરણ માટે ફરવા જતા અને વિચરણ કરીને પાછા આવે ત્યારે સંતોને ભેટવું. અને ૩. ભગવાન શ્રીહરિના જે શરણાગત બને અને



સિંતન

એપ્રિલ  
૨૦૧૫

૧૧




અનન્યભાવથી એક દૃઢનિષ્ઠાથી જોડાઈ, જેને અન્ય કોઈ જગ્યાએ પ્રીતિ ન હોય એવા ભક્ત ગમે ત્યાં, ગમે તેવી પરિસ્થિતિમાં દેહ મૂકે તેને **સ્વયં શ્રીજીમહારાજ** તેડવા પધારે છે. ભક્તને ભગવાનના પાર્ષદો તેડવા પધારે છે તેવું તો બનતું હતું, પણ સ્વયં સર્વોપરી પુરુષોત્તમ નારાયણ પોતાના આશ્રિતજનને અંતકાળે ધામમાં તેડવા પધારે - એવા તો દયાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ જ છે. માટે ખાસ અનુસંધાન રાખજો કે, હવે આપણે નાશવંત પદાર્થને માટે આ સર્વોપરી ભગવાનને મૂકીને અન્ય સ્થાનમાં વળગી ન જઈએ.

❖ હૃદયમાં એક ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજામાં એક ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ઘરમંદિરમાં પણ ભગવાન શ્રી સ્વામિનારાયણ. એ વિના કોઈ ન હોય. આવી નિષ્ઠા દૃઢ હશે તો જ અક્ષરધામમાં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણનું સાંનિધ્ય પ્રાપ્ત થશે. પ્રાપ્તિ મહાન છે પણ ઓળખાણ થવી તે કઠણ કામ છે.

હાલા ભક્તજનો! તમે ગૃહસ્થ છો, કદાચ તમારા સંબંધ એવી જગ્યાએ થાય કે, જ્યાં સત્સંગ ન હોય. અને તમારી સાથે મંગળફેરા ફરીને આવેલા સ્ત્રીને સત્સંગ ન હોય, પરંતુ તમારા ઘરમાં જો અડીખમ સત્સંગ હશે તો એમને પણ સત્સંગના રંગે રંગાતા વાર નહિ લાગે. પણ પોતાને ત્યાં જ જો ગોબરગંડવાણું હોય, પછી પાછા એમ કહીએ કે, ઘરના સ્ત્રીના પિયરમાં સત્સંગ નથી એટલે બધું રાખવું પડે છે...!! શા માટે આવા બહાના કાઢવા પડે? જો દૃઢ સર્વોપરી નિષ્ઠા ઘરમાં હોય તો આવનાર પરણિત નારીને પણ સત્સંગ થઈ જાય.

❖ મુંબઈ થાણામાં અમરશીભાઈ નિસર કરીને એકાંતિક હરિભક્તનો પરિવાર રહે છે. (જગન્નાથપુરી મહોત્સવ - ૨૦૧૨ના યજમાનશ્રી) મૂળ નવાગામ-ભચાઉ કચ્છના જૈન વાણિયા છે. એના તમામ સગાસંબંધી પણ જૈન છે. અમરશીભાઈના સસરા પણ જૈન, એના ભાઈના સસરા પણ જૈન છે, એમની બહેનોનું સાસરું પણ જૈન ધર્મમાં આસ્થા ધરાવે છે. પરંતુ પોતાના ઘેર આવેલ તમામ સ્ત્રીઓને સત્સંગના રંગે રંગીને પરમ એકાંતિક ભક્ત બનાવીને સુદૃઢ કર્યા છે.

પરંતુ જો સત્સંગી હરિભક્તની બહેન-દીકરીઓ સાસરે



ભક્તને ભગવાનના પાર્ષદો તેડવા પધારે છે તેવું તો બનતું હતું, પણ સ્વયં સર્વોપરી પુરુષોત્તમ નારાયણ પોતાના આશ્રિતજનને અંતકાળે ધામમાં તેડવા પધારે - એવા તો દયાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ જ છે.

જઈને લસણ-ડુંગળી આદિક સંપ્રદાયની ત્યાજ્ય વસ્તુ-પદાર્થનો ઉપયોગ કરવા લાગે ત્યારે સમજવું કે, સત્સંગીના ઘરમાં સત્સંગ હતો જ નહિ, કેવળ સત્સંગીનું લેબલ લગાડ્યું હતું. જે ઘરમાં રોમેરોમ સત્સંગના પીયુષોનું રસપાન કર્યું હોય તે ઘરની બહેન-દીકરીઓ જ્યાં પણ જાય ત્યાં તે ઘર તો સત્સંગમાં વૃદ્ધિ પામે જ, પરંતુ તેના આજુબાજુના આડોશીપાડોશીને પણ સત્સંગમાં સામેલ કરીને સારા હરિભક્ત બનાવી દે. અને સત્સંગીના ઘરમાં આવેલ સ્ત્રીઓ જો લસણ-ડુંગળી ખાતા થઈ જાય અથવા તો ઉપાસનામાં ફેર પડી જાય તો સમજવું કે, આપણા ઘરમાં સત્સંગ જ નહોતો.

આ સંપ્રદાયના, આ સત્સંગના સદ્ગુણો એટલા બધા ઉજ્જવળ છે કે, સત્સંગના કથામૃતનું રસપાન કર્યા પછી તેના પ્રસંગમાં આવનાર સત્સંગી થઈ જાય અને સત્સંગીના ઘરમાં સાસરે જનારને પણ સત્સંગી કરી દે.

❖ મુંબઈ ડોંબીવલીમાં હિંમતભાઈ લાખાણી નામે એક સારા હરિભક્ત છે. તેમને લગ્ન થયા પૂર્વે સત્સંગ હતો નહિ, પણ તેમના સાસરાપક્ષમાંથી સત્સંગ મળ્યો છે. લગ્ન પછી તેમના પત્ની સત્સંગ નિયમો પાળે તે તેમને ગમે નહિ. શરૂઆતના દિવસોમાં તો હિંમતભગત બહુ ખીજાતા અને નિયમોમાં પાળવા દે નહિ, ક્યારેક ક્યારેક રોટલી ઉપર ડુંગળીના ફોતરા ઘસી નાખે. તોપણ તેમના પત્નીએ સત્સંગને છોડ્યો નહિ ને વધુને વધુ મજબુતાઈથી તેઓ દૃઢ થયા. પછી હિંમતભગતના મનમાં થયું કે, એમનો સત્સંગ ને સંપ્રદાય સાચો છે. નહિ તો આ બને નહિ. પછી હિંમતભગતે પોતાની પકડ છોડીને સત્સંગને સ્વીકારી લીધો.

વાત સમજાય છે? પરીક્ષા - કસોટી જરૂર થાય, પરંતુ જો સાચી વાતમાં મચક નહી આપશો તો એક દિવસ ભલભલાને વાત સ્વીકારવી પડશે. માળા બે ઓછી ફરશે તો ચાલશે, પણ ઉપાસનામાં ગોટાળો નહિ ચાલે. ઉપાસના તો એક ભગવાન શ્રી સ્વામિનારાયણની જ હોય !!

❖ ગાંધી ગામના વસ્તા રાવળનો પ્રસિદ્ધ ઈતિહાસ છે. તેમને ભગવાન શ્રી સ્વામિનારાયણનો માહાત્મ્ય સહિત દૃઢ નિશ્ચય હતો. તે ગામના ભક્તોને શ્રીજીમહારાજે કહ્યું હતું કે, “મને નારદજી જેવો કે શુકજી જેવો કહેવો પણ એથી







યોગીચોક-સુરતને ખાતે પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાન્નિધ્યમાં પીઠવડી નિવાસી કથીરીયા પરિવાર દ્વારા પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના વક્તાપદે યોજાયેલ 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ' (તા. ૧૦ થી ૧૮-૩-૨૦૧૫)

૧. કથા મહોત્સવના યજમાન પ.ભ. શ્રી અરવિંદભાઈ, કાળુભાઈ તથા અશોકભાઈ કથીરીયાના નિવાસસ્થાને મુખ્ય પોથીજી તેમજ ૧૦૮ સંહિતાપોથીનું પૂજન કરતા પૂ. નાનાલાલજી મહારાજશ્રી. ૨. પોથીયાત્રામાં ૧૦૮ પોથીજીને મસ્તક ઉપર ધારણ કરતા યજમાન સ્ત્રીભક્તો. ૩. મહોત્સવનું દીપ પ્રાગટ્ય કરતા પૂ. નાનાલાલજી મહારાજશ્રી તથા પૂ. સંતો અને યજમાન પરિવાર. ૪-૫-૬. સુરતના મુખ્ય માર્ગો ઉપર નીકળ પ.પૂ. લાલજી મહારાજશ્રીની ભવ્ય શોભાયાત્રા. ૭. પ.પૂ. લાલજી મહારાજશ્રીનું કીર્તન નૃત્યથી સ્વાગત કરતા શ્રી પુષ્પેન્દ્ર બાળમંડળ શ્રીજીમંદિરના બાળકો. ૮-૯. કથા અંતર્ગત પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાન્નિધ્યમાં શ્રી ધનશ્યામ પ્રાગટ્યોત્સવની ઉજવણી. ૧૦. કથા અંતર્ગત જેતપુર ગાદિ-પટ્ટાભિષેક. ૧૧. અન્નકૂટોત્સવ. ૧૨. યજમાન પરિવારનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરતા પૂ. વક્તાશ્રી, પૂ. લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, પૂ. કોઠારી સ્વામી - સરધાર વગેરે પૂ. સંતો-ભક્તો.

સ્વામિનારાયણ એપ્રિલ - ૨૦૧૫ - ૨૦૧૫ (૧૩)



કચીરીયા પરિવાર આયોજીત

# શ્રીમદ્ સત્સંગિજીવન કથા મહોત્સવ

સુરત





યોગીયોક-સુરતને ખાતે પ.પૂ. ધ.પુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી પ.પૂ. લાલજી મહારાજશ્રીના દ્વારા પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના વક્તાપદે યોજાયેલ 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ'





સાન્નિધ્યમાં પીઠવડી નિવાસી કથીરીયા પરિવાર  
(તા. ૧૦ થી ૧૮-૩-૨૦૧૫)



સ્વામિનારાયણ એપ્રિલ - ૨૦૧૫ - ૨૦૧૫ (૧૫)





॥ શ્રી સ્વામિનારાયણો વિજયનેતરામ ॥

વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિઆચાર્ય

પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું સંતમંડળ સાથે

# USA સત્સંગ પરિભ્રમણ - ૨૦૧૫

:: Date ::

20<sup>th</sup> May to 14<sup>th</sup> June 2015

:: Date ::

22<sup>nd</sup> July to 26<sup>th</sup> July 2015

હાલા ભક્તજનો ! સર્વાવતારી, સર્વોપરી ઈષ્ટદેવ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ દક્ષિણ વિભાગ વડતાલ દેશ પીઠાધિપતિ પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી વિદેશમાં વસતા હરિભક્તોના આમંત્રણને માન આપી, સત્સંગ વૃદ્ધિ, વિકાસ, સદ્ગર્ભ અને શ્રીજીમહારાજ સ્થાપિત સિદ્ધાંતોનું પોષણ અને બળ આપવા માટે અમેરિકાની ધરતી પર દર વર્ષેની જેમ આ વર્ષે પણ પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી બ્રહ્મનિષ્ઠ પૂ. સંતોની સાથે સત્સંગ પ્રચારાર્થે પધારી રહ્યા છે. તો આપ સર્વે ભક્તજનોને આ સત્સંગનો દિવ્ય લાભ પ્રાપ્ત કરવા સહકુટુંબ-મિત્રમંડળ પરિવાર સહિત પધારવા અમારું નેહનિતરતું નિમંત્રણ છે તો અવશ્ય પધારી કૃતકૃત્ય બનશો-બનાવશોજી.

લી. ધર્મકુળ આશ્રિત ઈન્ટરનેશનલ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ - યુ.એસ.એ

## :: Satsang Sabha Schedule ::

Date	Place	Event	Contact Person	Phone no.
20 <sup>th</sup> May to 24 <sup>th</sup> May	S.N. Tempele - Chicago	24 <sup>th</sup> Patotsav	Rajinibhai Patel	(773) 531 9687
25 <sup>th</sup> May to 26 <sup>th</sup> May	Detroit Mi	Satsang Sabha	Pinakinbhai Patel	(248) 303 8045
27 <sup>th</sup> May	Cleveland OH	Satsang Sabha	Bharatbhai Thakkar	(440) 358 0094
28 <sup>th</sup> May to 30 <sup>th</sup> May	S.N. Temple - Scranton	Katha	Dineshbhai Patel	(936) 240 3822
31 <sup>st</sup> May to 1 <sup>st</sup> June	Toronto - Canada	Satsang Sabha	Jagdishbhai Patel	(416) 277 8556
2 <sup>nd</sup> June	Bosten MA	Satsang Sabha	Shyamal Patel	(732) 766 8690
3 <sup>rd</sup> June to 7 <sup>th</sup> June	S.N. Tempele - Houston TX	Khatmurhat	Madanmohan Patel	(832) 875 2163
8 <sup>th</sup> June	Austin TX	Satsang Sabha	Jigneshbhai Patel	(512) 619 0122
9 <sup>th</sup> June	Dallas TX	Satsang Sabha	Ajaybhai Soni	(214) 704 0791
10 <sup>th</sup> June to 11 <sup>th</sup> June	San Francisco CA	Satsang Sabha	Parimalbhai Patel	(925) 998 9410
12 <sup>th</sup> June to 14 <sup>th</sup> June	Los Angeles CA	Katha	Jagdishbhai Patel	(714) 858 5647
22 <sup>th</sup> June to 26 <sup>th</sup> July	New Jersey	Katha & Shibir	Dhirubhai Patel	(732) 930 1008

**Katha Vakta : Swami Shree Nityaswarupdasji & Swami Purnaswarupdasji - Vadtal (Sardhar)**

**For More Information Please Contact :- 732-930-1008**

For More Information & Live broadcast Please Visit: [www.svg.org](http://www.svg.org)

સર્વે ભક્તજનોને ઘણા હેતુપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ... JAY SHREE SWAMINARAYAN

મોટો કહેવો નહીં.”

એકવખત ગામના રાજાએ ભાગવતની કથા કરાવી. કથા સત્સંગીને કુસંગી એમ બધા ગામના લોકો સાંભળવા માટે જતા હતા. એકાંતિક ભક્તરાજ વસ્તા રાવળ પણ કથા સાંભળવા માટે જતા. તેઓ સૌની પહેલા જઈને આગળ બેસી જતા. પછી પોતાને છીંક આવે ત્યારે ‘સ્વામિનારાયણ...’ બગાસુ આવે ત્યારે પણ ‘સ્વામિનારાયણ...’ મહામંત્ર ઉચ્ચારે. પછી એક દિવસ દરબારે સૌ સત્સંગીઓને કહ્યું : “વસ્તો રાવળ ભાગવતની કથા સાંભળે છે અને છીંક આવે કે બગાસુ આવે ત્યારે ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ’ બોલે છે. માટે તમે સૌ પૂછી કે, રામચંદ્રજી થયા તેમણે સમુદ્ર ઉપર પાળ બાંધી અને રાવળ આદિક રાક્ષસને માર્યા અને શ્રીકૃષ્ણ ભગવાન થઈ ગયા તેમણે કંસાદિક રાક્ષસને માર્યા અને શ્રી ગોવર્ધન પર્વત તોળ્યો તેણે કરીને ભગવાન કહેવાય છે. પરંતુ આ સ્વામિનારાયણે એવું શું ચરિત્ર કર્યું છે કે ‘ભગવાન’ કહો છો ?”

ત્યારે વસ્તા રાવળ કહે : “તમને ખબર નહીં રામે તથા કૃષ્ણે જે જે ચરિત્ર કર્યા તે સ્વામિનારાયણે આજ્ઞા કરી તેટલું જ કર્યું છે પણ તેથી વિશેષ કર્યું નથી.” ત્યારે મનુભા દરબાર બોલ્યા : “લ્યો, જુઓ તો આ રાવળજીએ તો સૌના કારણ સ્વામિનારાયણને કહ્યા.” પછી સર્વે હરિભક્તોએ વસ્તા રાવળને કહ્યું : “શ્રીજીમહારાજે કહ્યું છે કે, મને નારદજી જેવો કે શુકજી જેવો કહેવો પણ એથી મોટો કહેવો નહીં અને તમે કેમ સર્વોપરી કહો છો ?” ત્યારે વસ્તા રાવળ કહે : “હું તો મહારાજને જેવા જાણું છું તેવા કહીશ.” ત્યારે હરિભક્તોએ કહ્યું : “શ્રીજીમહારાજની આજ્ઞાનો તમે લોપ કર્યો છે, માટે વિમુખ છો. તમે હવે મંદિરમાં આવશો નહિ.” વસ્તા રાવળ કહે : “મારે મંદિરે આવ્યા વિના રહેવાશે નહીં.”

થોડા દિવસો પછી ભગવાન શ્રીહરિ વડતાલ પધારતા હતા. તે ગાંકને પાદર આવ્યા ત્યારે ગામના સૌ હરિભક્તો મહારાજના દર્શન કરવા આવ્યા. બધા જ હરિભક્તો શ્રીજીમહારાજનો ચરણસ્પર્શ કરતા હતા. પણ વસ્તા રાવળ દૂર ઊભા રહીને પગે લાગ્યા. ત્યારે મહારાજ કહે : “રાવળજી ! નજીક આવોને.” ત્યારે હરિભક્તો કહે : “મહારાજ !



ઉપાસક થઈએ તો એવા દેઢ થઈએ કે, જિંદગીમાં બીજી મચક ન આવે. સુખ આપે તોય ભલે અને દુઃખ આપે તોપણ ભલે. ભગવાન શ્રીહરિ વિના બીજે મસ્તક ઝૂકે નહિ.

અમે તેમને વિમુખ કર્યા છે.” મહારાજ કહે : “વર્તમાનમાંથી કાંઈ ચૂક્યા કે શું ?” ત્યારે હરિભક્તો કહે : “ના. મહારાજ ! તે વર્તમાનમાંથી તો કાંઈ ચૂક્યા નથી પણ ‘રામે તથા કૃષ્ણે જે જે ચરિત્ર કર્યા તે સ્વામિનારાયણે આજ્ઞા કરી તેટલું જ કર્યું છે પણ તેથી વિશેષ કર્યું નથી’ આમ બોલે છે.”

પછી શ્રીજીમહારાજે કહ્યું : “વસ્તા રાવળ ! કેમ આવું કહો છો ? અમે આજ્ઞા કરી છે કે, અમને બીજા અવતાર જેવા કહેવા અને તેમ છતાંય અવતારી કેમ કહો છો ?” ત્યારે વસ્તા રાવળ કહે : “હે મહારાજ ! આપ સર્વકારણના કારણ અને સર્વોપરી છો એટલું કહું છું. અને આપ કદાચ અવતાર જેવા કહેવાનું કહો તોપણ

આપની જે અવતારીપણાની મહત્તા છે તે ઓછી થાય એમ નથી. આપ તો સર્વાવતારી ભગવાન જ છો.”

આ વાત સાંભળીને શ્રીજીમહારાજ માણકી ઘોડીએથી નીચે ઉતર્યા. પછી વસ્તા રાવળને પાસે બોલાવીને મહારાજ તેમને ભેટીને વાંસો થાબડ્યો. અને કહ્યું : “કહેજે, કહેજે, કહેજે જા. એ મને સર્વોપરી જાણે છે તે સર્વોપરી જ કહે અને તમે એવો જાણતા નથી. ઉપાસક હોય તો આવા !! અમારા પાડ્યા પણ પડ્યા નહિ. અમે આજ્ઞા કરી તોપણ તેઓ ઉપાસનામાંથી ડગ્યા નહિ.” માટે ભગવાનના ભક્તો ! ઉપાસક થઈએ તો એવા દેઢ થઈએ કે, જિંદગીમાં બીજી મચક ન આવે. સુખ આપે તોય ભલે અને દુઃખ આપે તોપણ ભલે. ભગવાન શ્રીહરિ વિના બીજે મસ્તક ઝૂકે નહિ. આ તો જરાક દુઃખ આવે ત્યાં તો નિષ્ઠામાં ફેર પડી જાય. અઠવાડીયું માથું દુઃખનું હોય ત્યાં તો ત્રણ જગ્યાએ દોરો કરાવીએ. દેહના કટકા થઈ જાય તોપણ બીજે નિષ્ઠા થાય નહિ ત્યારે આપણી સાચી ઉપાસના કહેવાય.

સ.ગુ. અક્ષરાનંદ સ્વામીએ પોતાની વાતોમાં નિશ્ચય સંબંધી ઘણા પ્રસંગો લખ્યા છે, તેમાંથી થોડું આયમન કરીએ :

✦ ગામ કરિયાણામાં દાદોબાચર કરીને ગામધણી હતા અને તે શ્રીજીમહારાજના મળેલા હતા. પછી તે ગામમાં ગામ ખસનો બાવો કનહીરામ કરીને ગયો હતો. તે બાવો આખા ડાયરામાં કંઠી બાંધતો હતો. પછી દાદાબાચરને કંઠી બાંધવા આવ્યો. ત્યારે દાદાબાચરે પોતાનો પગ લાંબો કર્યો. ત્યારે કનહીરામ કહે, ‘બાપુ ! આમ કેમ ?’ ત્યારે દાદોબાચર કહે,





‘ડોકમાં તો સ્વામિનારાયણની કંઠી છે અને તારા જો ભાગ્ય હોય ને તારા જીવનું કલ્યાણ કરવું હોય તો મારા પગ સુધી તારી કંઠી ક્યાંથી ? અને હું સ્વામિનારાયણનો મળેલો છું.’ એમ કહીને પોતે કંઠી નાંખવા દીધી નહીં. ત્યારે બાવો કહે, ‘બાપુ ! હું કનહીરામ.’ ત્યારે દાદોબાચર કહે, ‘હું કરિયાણા ગામનો દાદોબાચર.’ પછી બાવો ચાલ્યો ગયો પણ કંઠી પહેરી નહીં. 11૨૮૧1

✱ ગામ ઝીંગોડામાં હાથીયો માંઝરીયો કરીને કાઠી હતો. પછી તે ગામનાં લોક સૌ ગંગાજીયે જાવને તૈયાર થયાં. ત્યારે કેટલાકે કહ્યું જે, ‘હાથીયા માંઝરીયા ! ભાતો કરો ભાતો. આપણે સૌ ગંગાજી જઈએ.’ ત્યારે હાથીયો કહે, ‘હું તો હમણાં ગંગાજીએ જઈ આવ્યો.’ ત્યારે કહે, ‘ક્યારે ?’ ત્યારે કહે, ‘હું હમણે ગઢપુર જઈને ડોળીયાને ને કાબરીયાને (બે બળદને) નવરાવી આવ્યો. તેમાં ડોળીયો તો ધામમાં ગયો ને કાબરીઓ તૈયાર થયો છે.’ ત્યારે કોઈકે કહ્યું જે, ‘ઘેલામાં તો પાણી સુકાઈ જાય છે.’ ત્યારે હાથીયો કહે જે, ‘ત્યાંની વેળું કાંઈ સુકાઈ જાય છે ? ત્યાંનો કાંકરો લઈને માથે મેલીયે તો પણ કલ્યાણ થાય. એવો ગઢપુરમાં ઘેલા નદીનો મહિમા છે. જેમ ઢીંચણ સામો ઝીંઝવો ગામને પાદર ડોલતો હોય ને મૂરખ હોય તો વાંઢે ધોળે.’ (બીજે ગામ જાય) 11૨૮૨1

✱ ગામ મોલડીમાં ઉગો ખુમાણ કરીને કાઠી હરિભગત હતો. એને ગઢપુરથી એક ચારણ ગયો. ત્યારે તે ચારણે તેને વાત કરી જે, ‘ઉગા ખુમાણ ! સ્વામિનારાયણ તો પોતાના સત્સંગીઓને રુદ્રાક્ષનો એક-એક પારો ગળે બંધાવે છે.’ ત્યારે ઉગો ખુમાણ કહે, ‘ગઢવા ! રુદ્રાક્ષનો પારો તો સારો. પણ સ્વામિનારાયણ કહેશે કે સુકું ખાસડું લઈને શાહરીને ગળે બાંધો તો તે બાંધવું છે પણ સ્વામિનારાયણ તો ભગવાન છે બા.’ પછી તે સાંભળીને ગઢવો ચાલતો થયો. 11૨૮૩1

✱ ગામ મીતીયાળામાં રાવત મૈતરો કરીને કાઠી હરિભક્ત હતો. તે ગામમાં એક બાવી રહેતી હતી. તે બાઈ કાશીએ ગઈ અને વરસદિવસે પાછી આવી. ત્યારે પોતાની સાથે આઠ બાવા લેતી આવી હતી. તે નવે જણે આવીને ચોરે પાણીની કાવડું ઉતારી. તે વખતે તે ગામના બધા કાઠીઓ ચોરે બેઠા

હતા. તે ઊઠી ઊઠીને માતાના પગમાં પડ્યા પણ રાવત મૈતરો ઉઠ્યો નહીં. ત્યારે સૌ કાઠી કહેવા લાગ્યા જે, ‘રાવત મૈતરા ! માતાને પગે લાગો માતા આદાં માતા કાશીએ જઈને આવ્યાં અને સાથે આઠ બાવા લાવ્યા.’ રાવત મૈતરો કહે, ‘તમે પગે લાગ્યા તે ઘણું કર્યું.’ તો પણ કાઠીએ બહુ આગ્રહ કર્યો એટલે ચોરા પાસે એક ગધેડી ઊભી હતી. તેને રાવત મૈતરો જઈને પગે લાગ્યો અને કહ્યું જે, ‘હે ગધેડીમા ! આ સોળ સંઢી જો સૌનું કલ્યાણ કરે તો તું મારું કરજે. તે જોઈ સૌ કાઠી બોલ્યા જે, ‘રાવત મૈતરા! આ શું કર્યું ?’ ત્યાં જઈ કેમ પગે લાગ્યા ?’ ત્યારે રાવત મૈતરો કહે કે, તારી મામાં ને મારી મામાં શો ફેર છે ? તારી માને સોળ પતિ તો મારી માને એક પતિ. આ આઠ સાથે લાવી છે અને આઠ બીજા કર્યા હશે ને માણી માને તો ગધાડી એક જ પતિ. તે સાંભળી કાઠી સૌ બોલતા બંધ થઈ ગયા. આનું નામ નિશ્ચય કહેવાય. 11૨૮41



નીતિથી કમાવાનો આગ્રહ રાખવો. નીતિથી કમાશો તો પ્રાપ્ત થયેલું ધન સુખરૂપ બનશે. અનીતિથી ધનને આધીન બનીને જો કમાવાનો પ્રયાસ કરશો તો એવું ધન કઠી પણ સુખ લેવા નહીં દે. હંમેશને માટે દુઃખનું કારણ બની જશે.

✱ ગામ રતનપુરમાં જસમત કરીને એક કણબી હરિભગત હતો અને તે નવા સત્સંગી થયા હતા પણ પોતાને પૂર્વનો સંસ્કાર જબરો હતો. તેથી એકાંતિકપણાને પામ્યા હતા. પછી એક દિવસ તે સુતા હતા અને તેમના દીકરાને તાવ આવતો હતો. તે વખતે શ્રીજીમહારાજ માણકી ધોડીયે ચડીને આવ્યા અને જસમત પટેલને મહારાજે જગડ્યા અને કહ્યું જે, ‘શું સુતો છે ? તારા દીકરાને તેડવા માટે હું આવ્યો છું.’ ત્યારે જસમત પટેલ કહે, ‘મારાં ધન્ય ભાગ્ય અને ધન્ય ઘડી હું કણબી વરણ તે ભગવાન મારે ઘેર ક્યાંથી ? માટે સુખેથી મારા દીકરાને તેડી જાઓ.’ ત્યારે મહારાજ કહે, ‘આજથી પંદરમે દિવસ તારા બીજા દીકરાને પણ તેડી જાશું.’ એમ કહીને મહારાજ તે દીકરાને તેડીને પધાર્યા અને પટેલે સૌને કહ્યું જે, ‘કોઈ રોશો નહીં કેમકે મારો દીકરો ભગવાનના ધામમાં ગયો છે.’ પછી તેને અગ્નિસંસ્કાર કરીને આવ્યા. ત્યારે પોતે સાકર મંગાવીને વહેંચી અને પંદર દિવસ થયા ત્યારે તેવી રીતે બીજા દીકરાને પણ તેડી ગયા તોય પણ મનમાં જરાય શંકા થઈ નહીં. માટે ભગવાનનો મહિમા જાણે તેને સંશય ન થાય. 11૩૧11

➡ આ જીવ કોઈને કોઈ બાહુનું કાઢીને ભગવાનથી કેમ દૂર થવાય એની જ મહેનત કરે છે. જીવાત્માને ભજન કરવું નથી ને ભગવાનની આજ્ઞા પાળવી નથી. જીવને વિષયભોગના

ઓખર કરવાની ટેવ પડી ગઈ છે. એટલા માટે તો જીવાત્મા મુક્તિપદ પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. ભગવાનની દયાનો પાર નહિને આ જીવની અવળાઈનો પાર નહીં. જીવાત્મા પોતાની અવળાઈમાંથી જે દિવસે બહાર નીકળશે ત્યારે જ જન્મમરણના દુઃખમાં છૂટી શકશે. ભગવાનના ભક્તો આ મનુષ્ય જન્મમાં જ નક્કી કરજો કે, અવળાઈમાત્ર છોડી દેવી છે અને ભગવાન સુધી પહોંચી જવું છે. આ અવસર અણમોલ પ્રાપ્ત થયો છે. જો આવી અવળાઈ રાખીશું તો આવો સુંદર અવસર જતો રહેશે. પછી પસ્તાવું પડશે.

► પરમાત્મા જેટલું ધન આપે એમાં

સંતોષ રાખજો. પુરુષાર્થ જરૂર કરવો પણ જે મળે એમાં સંતોષ રાખવો. નીતિથી કમાવાનો આગ્રહ રાખવો. નીતિથી કમાશો તો પ્રાપ્ત થયેલું ધન સુખરૂપ બનશે. અનીતિથી ધનને આધીન બનીને જો કમાવાનો પ્રયાસ કરશો તો એવું ધન કદી પણ સુખ લેવા નહીં દે. હંમેશને માટે દુઃખનું કારણ બની જશે. માટે આપણા પ્રારબ્ધનું આપણને મળવાનું છે, મળવાનું છે ને મળવાનું જ છે.

► ભગવાનના ભક્તોએ ઘરમાં સત્શાસ્ત્રો વસાવવાનો આગ્રહ રાખવો. ઘરને જો મંદિર જેવું કરવું હોય, જીવનને જો મુક્ત જેવી સ્થિતિએ પહોંચાડવું હોય તો ઘરમાં સારા ને સુંદર આધ્યાત્મિક શાસ્ત્રો વસાવજો. સારા શાસ્ત્રો, સત્સંગ (સારી સોબત) અને પ્રભુપ્રાર્થના એ ત્રણ માણસને ત્રિલોકનો સ્વામી બનાવે છે. **સ્વામી રામતીર્થ** ગરીબ હોવા છતાં કરકસર કરી, પૈસા બચાવી પુસ્તકો તથા તેલ ખરીદતા અને **૧૮ કલાક** વાંચતા....!!!

સદ્વાંચન આપણી અમૂલ્ય ધરોહર છે. આપણા ઈષ્ટદેવ અને આચાર્ય પરંપરા તથા બ્રહ્મનિષ્ઠ સંતોના અમૂલ્ય જીવનચરિત્રો કે એમના ઉપદેશ ગ્રંથો આપણા જીવનને સાર્થક બનાવવાની અદ્ભુત તાકાત છે. લોકોને સારા ગ્રંથો, સારા પુસ્તકોના વાંચનમાં રસ નથી. પહેલા પાનાથી છેલ્લા પાના સુધી છાપાં વાંચનારા કરોડો લોકોમાંથી સેંકડો પણ એવા નહીં હોય, જેમને સારા પવિત્ર ગ્રંથો કે પુસ્તકોમાં ઊંડો રસ હોય, જેઓ સદ્ગ્રંથોના વાંચનને ખોરાકની જેમ જીવનની-આત્માની એક

નથી, પરંતુ એનો ઉપયોગ કરનારાઓની અછત છે. મોટા શહેરોની લાખોની જનસમુદાયની વસ્તીમાં વિશાળ ગ્રંથાલયો જોવા મળે છે પણ તેમાં રચિ ધરાવનારી સંખ્યા કેટલી ? સિનેમાઘરોમાં કે ખાણીપીણીના સ્ટોર્સમાં ઊમટનારા લોકોની સાપેક્ષે લાઈબ્રેરીઓમાં જનારા લોકોની સંખ્યા નહીંવત હોય છે!!

માટે ભગવાનના ભક્તો પોતાના ઘરમાં શ્રી સત્સંગિજીવન, ભક્તચિંતામણી, વચનામૃત, શ્રીહરિલીલામૃત, શ્રીહરિચરિત્રામૃતસાગર, શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, આદર્શ ભક્તગાથાઓ, બ્રહ્મનિષ્ઠ સંતોના

જીવનચરિત્રો-ઉપદેશો, સ્વામીની વાતો વગેરે વગેરે ગ્રંથોને ઘરમાં વસાવજો. આ ગ્રંથો જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવાની અદ્ભુત તાકાત ધરાવે છે. કિશોરલાલ મશરૂવાળા કહે છે કે, આધ્યાત્મિક માર્ગે ચાલતા કોઈપણ સાધકને વચનામૃત જેવો ગ્રંથ વાંચ્યા વિના ભાગ્યે જ ચાલે. આપણા સદ્ગ્રંથોની આ અદ્ભુત આધ્યાત્મિક તાકાતથી આપણે આપણું અને આપણાં સંતાનોનું જીવન સાર્થક કેમ ન બનાવીએ ?

દરરોજ કરોડો ગુજરાતીઓ છાપાંઓ વાંચે છે. એની સામે સારા ગ્રંથો કે પુસ્તકોની માંડ એક-બે હજાર નકલો જ વેંચાય છે, અને તે પણ ચાર-પાંચ વર્ષે ! આવું કેમ બને છે ? એવું બનવું ન જોઈએ કે સારા ગ્રંથોની ખરીદી માટે પડાપડી થાય ? લાગે છે

કે, સારા ગ્રંથો કે પુસ્તકો માટે **માર્કેટીંગ**ની ખૂબ જરૂર છે. **માર્કેટિંગ**નો આ યુગ છે. સામાન્ય દૃષ્ટબ્રશ કે ગારમેન્ટથી લઈને મોંઘીદાટ લાખો રૂપિયાની મોટરકાર સુધી દરેક આઈટેમનું **માર્કેટિંગ** થાય છે. ઘરની બહાર નીકળો કે ઘરમાં હો, દિવસ-રાત અનેકાનેક **બહેરાતો**નો મારો સૌના મગજ પર અથડાતો રહે છે. પરંતુ એમાં કયાંય ગ્રંથો કે પુસ્તકોની જાહેરાત જોઈ ? ખાસ કરીને ગુજરાતમાં ક્યારેય એવું જોયું ? કારણ ? સદ્પરંપરા આપતા ગ્રંથોના **પ્રકાશનો** **માર્કેટિંગ**ની ભાતભાતની રીતો અપનાવે તો ગ્રંથની કિંમત વધી જાય. અને ગુજરાતી પ્રજાની ખાસ માન્યતા એ છે કે ધાર્મિક પુસ્તકો મફતમાં મળે તો શ્રેષ્ઠ ! નહિતર ઓછામાં ઓછી કિંમત મળવા જોઈએ.

આજે સમાજ લગ્નપ્રસંગોમાં કે ભોજન સમારંભોમાં અકલ્પ્ય ખર્ચાનો બોજ હસતે મોંએ વેઠે છે ! કપડાંમાં, ફિલ્મોમાં



સદ્વાંચન આપણી અમૂલ્ય ધરોહર છે. આપણા ઈષ્ટદેવ અને આચાર્ય પરંપરા તથા બ્રહ્મનિષ્ઠ સંતોના અમૂલ્ય જીવનચરિત્રો કે એમના ઉપદેશ ગ્રંથો આપણા જીવનને સાર્થક બનાવવાની અદ્ભુત તાકાત છે.





અને ફિલ્મોમાંથી શીખેલી ફેશનોને પોષવામાં પૈસાનું પાણી કરનારાની સંખ્યા અચંબો પમાડે તેવી મોટી છે. પણ એવા ખર્ચામાંથી ફક્ત દસમા ભાગનો જ ખર્ચો જો પ્રેરક સાહિત્ય વસાવવામાં કે પ્રકાશન કરવામાં મદદરૂપ થવામાં કરવામાં આવે તો? પોતાના ઘરનું દીવાનખાનું સજાવવામાં લાખો રૂપિયા ખર્ચતા લોકો એના થોડા ભાગના ખર્ચમાંથી સારા ગ્રંથો કે પુસ્તકો વસાવીને એનાથી દીવાનખંડને ખરા અર્થમાં સજાવે તો? વિચારપ્રેરક પુસ્તકોનું, સદ્ગ્રંથોનું જીવન-જરૂરિયાતમાં કે ક્યાંય સ્થાન જ નથી? પહેરામણીમાં કે કરિયાવરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરાય છે! તેની કોઈ ના નહિ, પરંતુ સારા પુસ્તકો પણ કરિયાવરમાં કે પહેરામણીમાં આપવા જોઈએ.

જો કે અહિં એક વાતનું ધ્યાન દોરવું ઘટે છે કે, સરધાર મંદિર દ્વારા સંપ્રદાયના શ્રી સત્સંગિજીવન, વચનામૃત, શિક્ષામૃત, કીર્તનામૃત, શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્તત્વી વહેરે ભગવાન, બાળવાટિકા, સંસ્કારદીપ વગેરે ગ્રંથોનું પ્રકાશન કરીને ઓછામાં ઓછી કિંમતે આપીને હજારો હરિભક્તોના ઘર સુધી સદ્ગ્રંથોને પહોંચાડવાની સફળ કામગીરી કરી છે અને કરી રહ્યા છીએ.

સદ્ગ્રંથો દ્વારા જ જીવાત્મા આ લોક અને પરલોકના માર્ગે ચાલી શકે છે. સદ્ગ્રંથોના શ્રવણમાત્રથી આ લોક પણ સુધરી જાય અને પરલોક પણ સુધરી જાય છે.

બાલા ભક્તજનો! આ સારા ગ્રંથો અને સારા પુસ્તકોની સાથે સાથે તમારા ઘરમાં ભગવાન શ્રીહરિના વિધવિધ સ્વરૂપોના ફોટાઓને વસાવજો. આચાર્ય પરંપરાની પ્રતિમાઓ અને નંદસંતોની પ્રતિમાઓને પણ રાખજો. તમારા ઘરમાં આધ્યાત્મિક પ્રવચનોની કે કીર્તનોની કેસેટો પણ વસાવજો. જેને લઈને તમારા માનસપટ પર વિચારના તરંગો પવિત્ર બની જશે.

ક્યારેક ક્યારેક તો કોઈના ઘેરે પધરામણી કરવા જઈએ ત્યારે આપણા હૃદયમાં બહુ જ દુઃખ થાય. આ હા! આ ઘરમાં તો સાત-સાત પેઢીનો સત્સંગ હતો, પણ અત્યારે દિવાલ સામી દૃષ્ટિ ન નખાય તેવા ઝિભત્સ ચિત્રો લગાડેલા હોય...!! તમારી ભાવિપેઢીનો વિનાશ સર્જવો હોય તો જ આવા ચિત્રો રાખજો. અને જો મુક્તકક્ષાએ પહોંચવું હોય તો સારા ગ્રંથોની સાથે ભગવાન અને મહાપુરુષોની પ્રતિમાઓ રાખજો.

અમો તો એમ કહીએ છીએ કે, ગૃહસ્થ ભક્તોએ પણ પોતાના દાંપત્યજીવનના ફોટા પાડ્યા હોય તોપણ તે મર્યાદામાં રહીને રાખવા. અને ભારતીય સંસ્કૃતિની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ક્યારેય તેવા ફોટા પડાવશો નહિ. આજે તમે યુવાન છો, કાલે તમે વડીલ થશો. માટે દાંપત્યજીવનના ફોટા તો એવા રાખજો કે, તમારા સંતાનો એના મિત્રો આવ્યા હોય તો એને પ્રેમથી તમારા ફોટાની ઓળખાણ કરાવી શકે.

■ ભેળું કરવામાં માલ નથી, છોડવામાં માલ છે. છોડનારા સર્જન કરી શકે, ભેળું કરનારો નહિ. ભેળું કરનારો તો વાસનીક બને અને ભૂત થાય છે, જ્યારે છોડનારા મુક્ત બની જાય છે. એકવખત બે શિષ્યો ગુરુઆશ્રમમાંથી ભણીને બહાર નીકળ્યા. એક શિષ્ય કહે કે, છોડવામાં મહાનતા છે. ત્યારે બીજો શિષ્ય કહે, ના - ભેળું કરવામાં મહાનતા છે. બંને વચ્ચે ખૂબ વાદ-વિવાદ થયો. એમાં ‘ભેળું કરનાર મહાન’નો દાવો કરનારની પાસે બે-પાંચ હજાર રૂપિયા પણ છે. ‘છોડવામાં મહાનતા છે’ એમ માનનારની પાસે એક પાય પણ નથી. તોપણ પોતાનો પક્ષ છોડતો નથી.

આ રીતે બંને ઝઘડો કરતા કરતા નદીના કિનારે પહોંચી ગયા. નદીને સામે કાંઠે જવાનું હતું. નદીમાં ખૂબ પાણી હોવાથી વહાણના સંગાથ વિના સામે પાર જવું મુશ્કેલ હતું. વહાણ ત્યાં હાજર હતા. પણ એણે કહ્યું : ‘સામે કાંઠે લઈ જઈ પણ એક વ્યક્તિના આઠ આના લાગશે.’ પેલો ભેળું કરવામાં માનવાવાળો શિષ્ય પેલા બીજા શિષ્યને કહે : ‘હવે તું સામે કાંઠે કેમ જઈશ? છે તારી પાસે કાંઈ?’

ત્યારે ‘છોડવામાં મહાનતા’ એમ માનનાર શિષ્યે કહ્યું : ‘ના, મારી પાસે કંઈ નથી.’ ‘હું આપી દઉં તારા?’

‘તારી ઈચ્છા હોય તો આપી દે !’ ત્યારે ‘ભેળું કરનાર’નો દાવો કરનારે બંનેના આઠ-આઠ આના ચૂકવી દીધા. પછી નદીને પાર કરી. પછી તે કહે : ‘હવે તું માની જા કે, ભેળું કરવામાં જ મજા છે. અને ભેળું કરનાર જ કામ કરી શકે !!’

ત્યારે બીજો શિષ્ય કહે : ‘ના, હું નહિ માનું. છોડનારો જ સર્જન કરી શકે. આ ભેળું કરવાથી કાંઈ નદી નથી પાર કરી શક્યા. બંનેના આઠ-આઠ આના છોડ્યા ત્યારે નદીને પાર ઉતર્યા છીએ.’ માટે ભગવાનના ભક્તો, છોડે એમાં મહાનતા છે. બસ, છોડવાની આદત પાડજો. ‘ત્યાગે એની આગે, અને માગે એનાથી સો ગાઉ દૂર ભાગે.’ અમુક વ્યક્તિના જીવન જ એવા હોય કે, એ જે વાતની હા પાડે એમાં લાખો લોકો તેના ભેળી હા કહી દે. અને અમુક વ્યક્તિ તો સાત પેઢીના સમ ખાયને તોપણ કોઈ હા ન પાડે. જીવન એવું બનાવીએ કે, આપણા વચન ઉપર હજારો ને લાખો લોકોને હા પડી જાય. આ વ્યક્તિ બોલ્યા છે એમાં ગમે તે સ્થિતિ નિર્માણ થાય તેમાં બીજી કોઈ વાત નહિ આવે. સત્સંગ કથાવાર્તાથી જ્યારે જીવનમાં ફેરફાર થાય ત્યારે સમજવું કે, હવે ભગવાનની ઓળખાણ થઈ છે. જીવન જ્યાં સુધી ન બદલે ત્યાં સુધી સમજવું કે, આપણને હજુ ભગવાન ઓળખ્યામાં આવ્યા જ નથી. અતિ વખાણના પડેલા શબ્દો પણ પરમાત્મા સુધી નહિ પહોંચવા દે અને નિંદાના મનોમંથનના શબ્દો પણ ભગવાન સુધી નહિ પહોંચવા દે. માટે બંનેથી પર થતાં શીખવું.

ક્રમશઃ



શિંતન



# સત્સંગ સમાચાર પત્રિકા


સ્વામી ઘનશ્યામદાસજી તથા શા. સ્વામી સર્વમંગલદાસજી તથા સાધુ ધર્મવલ્લભદાસજી

## ખોપાળા



ગઢડા પ્રદેશના ખોપાળા ગામને આંગણે યોજાયેલ દેવોના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ઠાકોરજીનો અભિષેક કરતા પ.પૂ. નાનાલાલજી મહારાજશ્રી.

## વડતાલ



શ્રી રઘુવીરવારી - વડતાલને આંગણે ધર્મકુળ પરિવારના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલ '૨૩૫મો ભગવાન શ્રીહરિનો પ્રાગટ્યોત્સવ'

પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી નાના સમઢીયાળાને આંગણે દોંગા પરિવાર આયોજીત



## શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયાણ

પ્રયોજક :- પૂ. સ.ગુ. સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી વડતા :- પૂ. સ્વામી શ્રી વિવેકસ્વરૂપદાસજી

તારીખ :- ૫ થી ૧૩ ૫-૨૦૧૫

પ.પૂ. લાલજી મહારાજશ્રીનું આગમન તા. ૯-૫-૨૦૧૫, સાંજે ૪.૦૦ કલાકે



પ.પૂ. આચાર્ય મહારાજશ્રી



પ.પૂ. લાલજી મહારાજશ્રી

નિમંત્રક : શ્રી વિદુલભાઈ સવજીભાઈ દોંગા

કથાસ્થળ : શ્રી ગોપીનાથ મહાદેવ મંદિર, નદીના કિનારે, મું. નાના સમઢીયાળા, તા. ઉના, જી. ગીર સોમનાથ.

સંપર્ક :- ગોપીનાથજી પેટ્રોલીયમ, ભાવનગર રોડ, ઉના. - મો. ૯૯૭૪૭૨૭૩૭૪






સિંતન

એપ્રિલ  
૨૦૧૫

૨૧






ગઢડા પ્રદેશના દેવળીયા ગામને આંગણે મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પૂ. સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજીના વક્તાપદે યોજાયેલ 'શ્રી હરિલીલામૃત કથા પારાયણ'



સ.ગુ. શ્રી મુકતાનંદ સ્વામીના જન્મસ્થાન અમરાપુર ગામને આંગણે વાળા પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત કથા પારાયણમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



જૂનાગઢ પ્રદેશના ભાયાવદરને આંગણે યોજાયેલ મંદિરના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે કથાપારાયણમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.

## રાજુલા



ગઢડા પ્રદેશના રાજુલા ગામને આંગણે યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથા પારાયણમાં પધારતા પ.પૂ. નાનાલાલજી મહારાજશ્રી.



## જૂના સાવર

ગઢડા પ્રદેશના જૂના સાવર ગામને આંગણે યોજાયેલ કથા પારાયણમાં પધારતા પ.પૂ. નાનાલાલજી મહારાજશ્રી.

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥

પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી જગન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર દ્વારા તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ વક્તા પૂ. સ.ગુ. સ્વામી નિત્યસ્યરૂપદાસજીના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ

## નૂતન હરિમંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવોની તિથિ-તારીખ

ક્રમ	કથા તારીખ	કથા તિથિ	પ્રતિષ્ઠા તિથિ	સ્થળ
૧.	૭-૫-૨૦૧૫ થી ૧૧-૫-૨૦૧૫	વૈશાખ વદ - ૩ થી વૈશાખ વદ - ૮	વૈશાખ વદ - ૮ તા. ૧૧-૫-૨૦૧૫	મુ. ગુંજર, તા.ધંધુકા, જી. અમદાવાદ સંપર્ક :- મો. ૯૬૬૨૪૨૩૨૮૭, ૯૬૬૨૧૪૯૯૪૮
૨.	૮-૫-૨૦૧૫ થી ૧૧-૫-૨૦૧૫	વૈશાખ વદ - ૫ થી વૈશાખ વદ - ૮	વૈશાખ વદ - ૮ તા. ૧૧-૫-૨૦૧૫	મુ. ધંધુકા, જી. અમદાવાદ સંપર્ક :- મો. ૯૪૨૮૪૯૯૩૦૮
૩.	૧૧-૫-૨૦૧૫ થી ૧૫-૫-૨૦૧૫	વૈશાખ વદ - ૮ થી વૈશાખ વદ - ૧૨	વૈશાખ વદ - ૧૨ તા. ૧૫-૫-૨૦૧૫	મુ. કોલડા, તા.કુંકાવાળ, જી. અમરેલી સંપર્ક :- મો. ૯૮૭૯૮૮૫૫૩૦
૪.	૧૨-૫-૨૦૧૫ થી ૧૬-૫-૨૦૧૫	વૈશાખ વદ - ૮ થી વૈશાખ વદ - ૧૩	વૈશાખ વદ - ૧૨ તા. ૧૫-૫-૨૦૧૫	મુ. વિરકી, તા. ગારીયાધાર, જી. ભાવનગર સંપર્ક :- મો. ૯૪૨૬૮૩૨૮૪૩, ૯૩૭૬૭૯૯૨૯૪
૫.	૧૫-૫-૨૦૧૫ થી ૧૭-૫-૨૦૧૫	વૈશાખ વદ - ૧૨ થી વૈશાખ વદ - ૧૪	વૈશાખ વદ - ૧૨ તા. ૧૫-૫-૨૦૧૫	મુ. સુકી સાજડીયાળી, તા.જી. રાજકોટ સંપર્ક :- મો. ૯૦૯૮૯૯૯૯૩૩

:: તારીખ ::

દર મહિનાના પહેલા રવિવારે સરધારધામમાં યોજાતી

:: સમય ::

તા. ૩-૫-૨૦૧૫

॥ અભયદાન માસિક સત્સંગ સભા ॥

સવારે ૯ થી ૧

સ્થળ :- શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર, તા.જી. રાજકોટ. ફો.નં. ૦૨૮૧ - ૨૭૮૧૨૧૧, મો. ૯૮૭૯૭૫૮૫૦૩



સ્વામિનારાયણ  
ચિંતન

એપ્રિલ  
૨૦૧૫

૨૩



પ.ભ. શ્રી વાલજીભાઈ વી. વરસાણીના

સિસલ્સ ગમનના


40 વર્ષ



અ.નિ. ધનભાઈ વાલજીભાઈ વરસાણીની

5

મી પુણ્યતિથિ પ્રસંગે



સરસ્વતીશ્રી ::

પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

ઉપાધ્યક્ષશ્રી ::

પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિરયાચાર્ય શ્રી જીજ્ઞેષ્ઠપ્રસાદજી મહારાજશ્રી

# શ્રી સ્વામિનારાયણ મહોત્સવ

૧૧ શ્રીમદ્ સત્સંગિજીવન ૧૧

:: તારીખ ::

6 થી 15 -8-2015

કથા સમય : બપોરે ૪:૦૦ થી ૮:૦૦

વક્તા : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી - સરધાર

:: નિમંત્રક તથા આયોજક :: પ.ભ. શ્રી હરિશભાઈ વાલજીભાઈ વરસાણી (હરિ બિલ્ડર્સ - સિસલ્સ)

સ્થળ : Hari Builders (Pty) Ltd, Victoria, Mahe - seychelles.

## ખાસનોંધ

કુદરતી સૌંદર્યથી ભરપૂર સિસલ્સ દેશમાં આયોજીત શ્રી સ્વામિનારાયણ મહોત્સવમાં જોડાવા ઈચ્છતા ભક્તો (સ્ત્રી-પુરુષ)એ તા. ૧૫-૫-૨૦૧૫ સુધીમાં નીચે જણાવેલ સંપર્ક પર પોતાના પાસપોર્ટ અને ફોટાની ૩-૩ ગ્રેડેશન કોપી અને ટીકીટ રકમ જમા કરવાની રહેશે.

બુકીંગ માટે સંપર્ક :- મીત દુર્લ અને ટ્રાવેલ્સ - રાજકોટ.

સતીષભાઈ - મો. ૯૯૯૮૮૯૨૧૦૮, ૮૫૩૦૮૧૨૩૪૫

E-mail : satish.mehta3@gmail.com

BANK DETAILS :

BANK : ICICI BANK RAJKOT

NAME : MEET TOURS & TRAVELS

A/C No. : 015305500652 ( CURRENT ACCOUNT )

JAHHIND PRESS BUILDING RAJKOT ( GUJRAT ) 360001

IFSC CODE : ICIC0000153

વધુ માહિતી માટે સંપર્ક

સરધાર :- પૂ. પતિતપાવન સ્વામી

મો. ૭૬૦૦૦૫૮૫૦૫

શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ॥

વડતાલ પીઠાધિપતિ પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના

રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સરધારધામને આંગણે અગિયારમો



સરસ્વતીશ્રી ::

પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

ઉપાધ્યક્ષશ્રી ::

પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિરયાચાર્ય શ્રી જીજ્ઞેષ્ઠપ્રસાદજી મહારાજશ્રી

# શ્રી સ્વામિનારાયણ બાળયુવા મહોત્સવ

2015

સરધાર

પ્રયોજક :- પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

પ્રારંભ તા. ૦૨-૫-૨૦૧૫

પુર્ણાહુતી તા. ૦૫-૫-૨૦૧૫

મહોત્સવ :- શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર, તા.જી. રાજકોટ







वडताल प्रदेशना कायावरोहण गामने आंगणो प.पू. ध.धु. आचार्य महाराजश्रीना  
 रुडा आशीर्वाद सह आज्ञाथी श्री स्वामिनारायण मंदिरना शताब्दी महोत्सव अंतर्गत  
 प.पू. लावछु महाराजश्रीना दिव्य सान्निध्यमां योजायेल पू. स.गु. स्वामी श्री नित्यस्वर्पदासजुना  
 वक्तापटे 'श्रीमद् सत्संगिजुवन कथा पारायण' (ता. २८ थी ३-४-२०१५)

स्वामिनारायण चिंतन, अप्रिल - २०१५ (२५)



શ્રીમદ્ ભાગવત કથા  
મહોત્સવ - રાજકોટ



રાજકોટને આંગણે પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી તથા પ.પૂ. લાલજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી જગતસિંહ એમ. જડેલ દ્વારા પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના વક્તાપદે યોજાયેલ 'શ્રીમદ્ ભાગવત કથા પારાયણ' (તા. ૫ થી ૧૧-૪-૨૦૧૫) સ્વામિનારાયણ ચિંતન, એપ્રિલ - ૨૦૧૫ (૨૬)



શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી આયોજીત

કીર્તન સંગીત - લોકસાહિત્ય - સંતવાણી - હાસ્ય તથા ગૌરવવંતા ગુજરાતની સામાજિક પ્રતિભાઓનો



અધ્યક્ષશ્રી

પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય  
શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

સર્વાવતારી  
ભગવાન શ્રી સ્વામિનારાયણ

ઉપાધ્યક્ષશ્રી

પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય  
શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

વર્ષ ૨૦૧૫ના સન્માનનીય રત્નાકરશ્રીઓ

તારીખ : ૫-૫-૨૦૧૫

મંગળવાર  
(સાંજે ૬.૦૦ કલાકે)



કીર્તન સંગીત રત્નાકર  
જયેશ સોની



લોકસાહિત્ય રત્નાકર  
માયાભાઈ આહિર



સંતવાણી રત્નાકર  
લક્ષ્મણ બારોટ



હાસ્ય રત્નાકર  
ધીરુભાઈ સરવૈયા

શુભેચ્છક : જૂનાગઢ શ્રી રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ ટ્રસ્ટીમંડળ, ગઢડા શ્રી ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડ ટ્રસ્ટીમંડળ

આયોજક : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાન સંસ્થાન - વડતાલ

સંયોજક :

પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

કાર્યક્રમ સંચાલન :

હરદેવ આહિર

(લોકસાહિત્ય તથા હાસ્ય કલાકાર)

સત્સંગ - કથા -  
મહોત્સવના ફોટા -  
ઓડિયો - વિડિયો માટે

૯૬૦૦૦૫૮૫૦૩

LIVE Streaming Online :  
[www.svg.org](http://www.svg.org)  
[www.sardhardham.com](http://www.sardhardham.com)

લાઇવ પ્રસારણ ▶



કીર્તન સંગીત :

અનમોલ ખત્રી  
નિલાદ્રી ચેટરજી  
હેમંત જોષી

લોકસાહિત્ય :

મેરાણ ગઢવી  
જીવુદાદ ગઢવી  
હરેશદાન ગઢવી  
અનુભા ગઢવી

સંતવાણી-ભજન :

કીર્તિદાન ગઢવી  
ઓસમાણ મીર  
બિહારી હેમુ ગઢવી  
અભેસિંહ રાઠોડ  
ખીમજી ભરવાડ

હાસ્ય ડાયરો :

ડૉ. જગદીશ ત્રિવેદી  
ઘનશ્યામ લાખાણી  
સુખદેવ ધામેલીયા  
જીવુભાઈ દ્વારકાવાળા  
મનસુખભાઈ વસોયા

સ્થળ : શ્રી સ્વામિનારાયણ બાગ, શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજકોટ-ભાવનગર હાઇવે - સરદાર, તા.જી. રાજકોટ



## ધર્મકુળ મિલન - ગઢડા



ગઢપુરપતિ શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજના દિવ્ય સાસિધ્યમાં અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ. ધ.પુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું દિવ્ય મિલન